

૫૫ મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ

આથી ધી લુણાવાડા પીપલ્સ કો.ઓ. બેન્ક લી. લુણાવાડાના સભાસદોને ખબર આપવામાં આવે છે કે બેન્કની ૫૫ મી વાર્ષિક સાધારણ સભા તા. ૧૪-૦૯-૨૦૨૫ ને રવિવાર ના રોજ સવારે ૯-૦૦ કલાકે શ્રી જૈન વાડી, કેરાફળીમાં નીચે જણાવેલા કામો માટે રાખવામાં આવી છે તો સર્વે સભાસદોએ સમયસર હાજર રહેવા વિનંતી છે.

કાર્યસૂચિ

૧. તા.૨૮-૭-૨૪ ની ૫૪ મી સાધારણ સભાનું પ્રોસીડીંગ બહાલ રાખવા બાબત.
૨. વ્યવસ્થાપક કમિટી તરફથી રજુ થયેલા તા.૩૧-૩-૨૦૨૫ સુધીનો એક વર્ષ સુધીનો કામકાજનો અહેવાલ નફાતોટા પત્રક તથા સરવૈયું મંજૂર રાખવા બાબત.
૩. સને ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષના નફાની વહેંચણી મંજૂર રાખવા બાબત.
૪. પેટા નિયમ-૭ પ્રમાણે ભંડોળની હદ નક્કી કરવા.
૫. વ્ય.ક. દરેક સભ્યોની પોતાની તથા જામીન તરીકેની વધુમાં વધુ કેટલી જવાબદારી લઈ શકે તે નક્કી કરવા.
૬. ઓડીટ નોટની નોંધ લેવા.
૭. પેટા નિયમ ૫૬ (બ) (૪) માં સુધારા બાબત.
૮. હાયર પરચેઝ ધિરાણ તથા સોના ચાંદીના દાગીના સાથે ધિરાણ મહીસાગર જીલ્લા ક્ષેત્રે મંજૂર કરવા બાબત.
૯. ચેરમેનશ્રીની મંજૂરીથી જે કંઈ રજુ થાય તે.

લુણાવાડા
તા. ૨૫/૦૮/૨૦૨૫

શ્રી રજનીકાંત વી. ગાંધી
ચેરમેન
ધી લુણાવાડા પીપલ્સ કો.ઓ બેન્ક લી.લુણાવાડા

- નોંધ :- (૧) સભાસદોએ આ અહેવાલની નકલ સાધારણ સભામાં સાથે લાવવી.
- (૨) કોરમના અભાવે મુલતવી રહેલ વાર્ષિક સાધારણ સભા તે દિવસે તે જ સ્થળે અડધા કલાક પછી મળશે. જેમાં કોરમની જરૂર રહેશે નહીં.
- (૩) કોઈપણ સભાસદને હિસાબો સંબંધી પૂછપરછ કરવી હોય તો ૭ દિવસ અગાઉ લેખીતમાં અરજી બેંકના ગ્રાહકના સમય દરમિયાન સવારે ૧૦-૩૦ થી બપોરના ૩-૩૦ સુધીમાં CEO ને આપવાની રહેશે.

સને ૨૦૨૪-૨૦૨૫

વાર્ષિક નિવેદન

સભાસદ ભાઈઓ અને બહેનો,

આપણી બેન્કે ઉત્તરોત્તર પ્રગતિના ૫૪ વર્ષ પુરા કરી ૫૫ માં વર્ષની વાર્ષિક સામાન્ય સભાના મંગલ પ્રસંગે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરતાં હું તથા વ્યવસ્થાપક કમિટી તથા શાખ કમિટીના સભ્યશ્રીઓ આનંદની લાગણી અનુભવે છે.

આપણી બેન્કની વ્યવસ્થાપક કમિટીએ મંજૂર કરેલ તા.૩૧-૩-૨૦૨૫ના રોજ પુરા થતા વર્ષના વાર્ષિક હિસાબો સરવૈયું તેમજ નફા-નુકશાન ખાતું અને બેંકીંગ કામકાજનો અહેવાલ રજૂ કરતા અનહદ્ આનંદ અને ગૌરવ અનુભવું છું.

તા.૩૧-૩-૨૦૨૫ ના રોજ પુરા થતા વર્ષનો કાચો નફો રૂ.૧૪૩૭૩૫૩૬૪-૪૯ પૈસા કરેલ છે. તેમાંથી આ સાથે આપેલા નફા - નુકશાન પત્રક મુજબ થાપણોનું વ્યાજ વહીવટી ખર્ચ વિગેરે બાદ કરતા બેન્કનો ચોખ્ખો નફો રૂ. ૧૮૮૫૬૫૫૨-૦૦ પૈસા રહે છે. તેની ફાળવણી આપણી બેન્કના પેટા નિયમ ૫૬ બ અને ૬ મુજબ નીચે જણાવ્યા પ્રમાણે કરવાનું નક્કી કરેલ છે. જેને આપ સૌની બહાલી મળી રહેશે તેવી અપેક્ષા રાખું છું.

પેટા નિયમ ૫૬ 'બ' અને 'ડ' મુજબ નફાની ફાળવણી

૧. રીઝર્વ ફંડ ખાતે ૨૫ %	૪૭૧૪૧૩૮-૨૫
૨. ડુબત ફંડ ખાતે ૧૫ %	૨૮૨૮૪૮૩-૦૦
૩. ઇન્વેસ્ટમેન્ટ ફલકચ્યુએશન રીઝર્વ	૨૧૧૫૨૩૧-૦૦
૪. ડીવીડન્ડ (૧૦% મુજબ*) (RBI ની મંજૂરીની અપેક્ષાસહ)	૩૩૨૯૪૬૪-૭૫
૫. શિક્ષણ ફંડ ૨% મુજબ	૨૦૦૦૦૦-૦૦
	૧૩૧૮૭૩૧૭-૦૦

ઉપર મુજબ ફાળવણી કર્યા બાદ રહેલ રૂ. ૫૬૬૯૨૩૫-૦૦ પૈસાની ફાળવણી નીચે મુજબ કરવામાં આવે છે.

૧. મકાન ફંડ ખાતે ૧૦ %	૫૬૬૯૨૩-૫૦
૨. ધર્માદા ફંડ ખાતે ૨૦ %	૧૧૩૩૮૪૭-૦૦
૩. સહકાર પ્રચાર ફંડ ખાતે ૫ %	૨૮૩૪૬૧-૭૫
૪. ઉજવણી ફંડ ૩૦ %	૧૭૦૦૭૭૦-૫૦
૫. રોકાણોના ઘસારા ફંડ ખાતે ૫%	૨૮૩૪૬૧-૭૫
૬. સભાસદ કલ્યાણનિધિ ૩૦ %	૧૭૦૦૭૭૦-૫૦
	૫૬૬૯૨૩૫-૦૦

- (૧) શેરભંડોળ : તા. ૩૧-૩-૨૦૨૪ આખરે ભરપાઈ થયેલ શેર ભંડોળ રૂ.૩૨૪૬૭૪૫૦-૦૦ હતું જેમાં વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના ધિરાણો વિગેરે માટે આપવા પડતા વધારાના શેરો મળી તા.૩૧-૩-૨૦૨૫ ના રોજ શેર ભંડોળ રૂ.૩૪૮૩૮૫૦૦-૦૦ થયેલ છે.
- (૨) રીઝર્વ તથા અન્ય ફંડો : તા. ૩૧-૩-૨૦૨૪ આખરે રીઝર્વ તથા અન્ય ફંડો રૂ. ૧૭૭૩૯૫૯૫૫-૬૫ ના હતા. જેમાં વધારો થઈ તા. ૩૧-૩-૨૦૨૫ આખરે રૂ. ૨૦૧૫૫૯૬૫૫-૮૮ થયેલ છે. જે રૂ.૨૪૧૬૩૭૦૦-૨૩ નો વધારો દર્શાવે છે.
- (૩) થાપણો : આપણી બેન્કની વહીવટી કાર્યક્ષમતા તથા ઊંડી સૂઝ અને આપણા શહેરની તથા આસપાસના ગામડાઓની જનતા, સભાસદશ્રીઓ તથા શુભેચ્છકોના અપ્રતિમ વિશ્વાસ અને સહકારથી તા.૩૧-૩-૨૪ ના રોજ થાપણો રૂ.૧૪૦૨૪૦૬૬૧૭-૨૮ પૈસા હતી. તા.૩૧-૩-૨૫ ના રોજ રૂ.૧૪૧૨૫૬૫૭૪૨-૨૨ પૈસા થયેલ છે થાપણોમાં રૂ. ૧૦૧૫૯૧૨૪-૯૪ નો વધારો દર્શાવે છે. જે માટે આપણી બેન્ક ઉપર વિશ્વાસ રાખવા બદલ સૌ થાપણદારોને અભિનંદન પાઠવું છું તથા ભવિષ્યમાં પણ આ જ વિશ્વાસ આપનો રહે તે જ પ્રકારના વહીવટની આપને અત્રેથી ખાત્રી અને વિશ્વાસ આપું છું. આપણી બેન્કની થાપણો ડીપોઝીટ ઇન્સ્યોરન્સ એન્ડ કેડીટ ગેરંટી કોર્પોરેશન દ્વારા વિમા હેઠળ રૂ ૧. પાંચ લાખ સુધી સુરક્ષિત છે તે માટે થાપણોના વિમાના પ્રિમીયમની રકમ તા.૩૦-૯-૨૫ સુધીના તા.૯-૪-૨૫ ના રોજ ભરી દીધેલ છે. જે આપની જાણ સારૂ જણાવું છું. આમ આપની થાપણો વિમાથી સુરક્ષિત છે.
- (૪) બેંકીંગ : આપણી બેન્ક તરફથી દરેક પ્રકારનું બેંકીંગ કામકાજ કરવામાં આવે છે. ભારતભરના ડીમાન્ડ ડ્રાફ્ટ વ્યાજબી કમીશનથી કાઢી આપવામાં આવે છે. હાલમાં આપણી બેન્ક RTGS/NEFT દ્વારા ભારતભરની કોઈપણ બેન્કમાં આપનાં નાણાં જમા કરાવી શકાય તે યોજના આપણી બેન્કમાં શરૂ કરેલ છે. તથા ભારતભરની કોઈપણ બેંકમાંથી આપની બેંકના તમારા ખાતામાં નાણાં જમા કરાવવા IFSC CODE HDFC OCLPCBL નો ઉપયોગ કરી જમા કરાવી શકાય છે. જેનો દરેકે લાભ લેવા વિનંતી
- (૫) ધિરાણો : તા.૩૧-૩-૨૦૨૪ ના રોજ રૂ. ૬૦૨૮૨૪૮૨૩-૨૨ પૈસા હતા જે તા.૩૧-૩-૨૫ ના રોજ રૂ.૭૦૦૨૫૨૩૫૭-૩૧ પૈસા થયેલ છે. રૂ ૧. ૯૭૪૨૭૫૩૪-૦૯ જેનો વધારો દર્શાવે છે. આપની બેન્ક થાપણોની વૃદ્ધિની સાથે સાથે સભાસદોની જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારના ધિરાણો આપવાની બાબતમાં બેન્કના કાર્યક્ષેત્રમાં વિકાસનો વ્યાપ વધુ ને વધુ ફુલે ફાલે તે જ ગણતરી સાથે ધિરાણો મંજૂર કરવામાં આવે છે. સાથે સાથે તેઓની નાણાં પરત ભરવાની શક્તિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આપણી બેન્ક જુદા જુદા પ્રકારના જેવા કે ધંધા-રોજગાર માટે ઘરગથ્થુ રીજવસ્તુઓ વસાવવા મોટર, સ્કૂટર ખરીદવાં, નવિન મકાન બાંધકામ માટે, રીપેરીંગ માટે તથા નવિન મકાન ખરીદવા માટે પણ બેન્કના નિયમોનુંસાર ધિરાણ આપે છે. વળી, રાષ્ટ્રિય બચતપત્રો, કિસાન વિકાસપત્રો વિગેરેને તારણમાં લઈ ધિરાણ આપવામાં આવે છે. સોના-ચાંદીના દાગીના સામે લોન ધિરાણની સગવડ કરેલ છે તો તેમાં જરૂરિયાતમંદોએ લાભ લેવા વિનંતી છે. મિલકત સામે કેશ કેડીટ ધિરાણની સગવડ કરેલ છે, જેનો લાભ લેવા વિનંતી.
- સોલાર : કોમશીયલ તથા રેસીડેન્સીયલમાં ક્યોટેશનના ૯૦% ધિરાણ મળશે.
- (૬) વિદ્યાર્થીઓને આપેલ ઇનામની વિગત : આપણી બેન્કના સભાસદોના સંતાનોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી સને ૨૦૨૩-૨૪ ના વર્ષ માં ઉત્તિર્ણ થયેલા સભાસદોના સંતાનોને પ્રોત્સાહન હેતુથી ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષમાં કુલ ૪૦ વિદ્યાર્થીઓને રૂ.૫૪૦૦૦/- પ્રોત્સાહક ઇનામ તરીકે આપવામાં આવેલ છે. ચાલુ વર્ષમાં પણ સભાસદશ્રીઓને નમ્ર વિનંતી છે કે પોતાના બાળકો મંગાવ્યા મુજબની કક્ષામાં આવતા હોય તો માર્કશીટની એક નકલ બેન્કમાં CEO ને આપવા ચોચ્ય કરશો.
- (૭) આપણા ખાતાના વ્યવહારની જાણ આપણા મોબાઈલ પર મેસેજથી આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.(SMS સુવિધા)
- (૮) ઓડીટ : તા.૧-૪-૨૪ થી તા.૩૧-૩-૨૫ સુધીનું ઓડીટ M/S. JOSHI PATEL BHATT & CO. ચાર્ટડ એકાઉન્ટન્ટ-વડોદરા દ્વારા કરવામાં આવેલ છે. અને ઓડીટ વર્ગ 'અ' આપેલ છે.
- (૯) આભાર : વધુમાં રીઝર્વ બેન્ક ફેડરેશન, ગુલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ મહીસાગર વિગેરેએ બેન્કની સધ્ધરતા, વિકાસ અને પ્રગતિમાં સાથ સહકાર આપેલ છે તેઓનો અત્યંત આભારી છું. અંતમાં આપણી બેન્કની વ્ય.ક.ના સભ્યશ્રીઓએ બેન્કના કામકાજમાં ઊંડો રસ લઈ સમયાંતરે ચોચ્ય માર્ગદર્શન આપ્યું છે તેમજ શાખ કમીટીના સભ્યશ્રીઓ, બેન્કના સભાસદો, વ્યાપારી બંધુઓ, ખાતેદાર તથા હિતેચ્છુઓએ બેન્કની પ્રગતિ અને વિકાસમાં સાથ અને સહકાર આપ્યો તે બદલ તેઓનો તથા બેન્કના કર્મચારીઓનો આભાર માનું છું.
- આપણી બેન્કે ૧૭ વર્ષથી સભાસદ કલ્યાણનિધિ ચોજનાનો અમલ કરેલ છે. કલ્યાણનિધિ સમિતિના સભ્યશ્રીઓ તરફથી મળેલ સહકાર બદલ તેઓશ્રીઓનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

લી.આપનો વિશ્વાસુ,
શ્રી રજનીકાંત વી. ગાંધી
ચેરમેન

તા.૩૧-૩-૨૦૨૫ ના રોજ

૩૧-૦૩-૨૦૨૪	લંડોળ અને દેવું	રૂા	પૈસા	૩૧-૦૩-૨૦૨૫
૫,૦૦,૦૦,૦૦૦ ૦૦	૧. લંડોળ (અ) અધિકૃત શેર લંડોળ ૧૦,૦૦,૦૦૦ શેર દરકે રૂા.૫૦નો (બ) વસુલ આવેલ શેરલંડોળ ૬૯૬૭૭૦ શેર દરેક રૂા.૫૦નો ભરપાઈ થયેલ ઉપર પૈકી ધારણ કરેલા			૫,૦૦,૦૦,૦૦૦ ૦૦
૩૨૪૬૭૪૫૦ ૦૦	(૧) વ્યક્તિઓએ (૨) સહકારી સંસ્થાઓ (૩) રાજ્ય સરકારશ્રીએ			૩૪૮૩૮૫૦૦ ૦૦
૪૪૩૫૬૪૯૮ ૮૪	૨. રિઝર્વ ફંડ તથા અન્ય રિઝર્વ (૧) અનામત લંડોળ	૭૬૬૪૩૫૩૬ ૩૬		
—	(૨) ખેતી વિષયક (ક્રેડીટ સ્ટેબી)ફંડ	—		
૪૧૫૯૭૨૪ ૦૦	(૩) બિલ્ડીંગ ફંડ	૬૯૯૫૯૩૦ ૦૦		
૧૯૬૬૦૮૧ ૦૦	(૪) ડિવિડન્ડ ઈક્વિલાઈઝેશન ફંડ			
૨૧૪૬૬૩૭૯ ૨૯	(૫) કુબત લેહણા સામે ખાસ રિઝર્વ			
૪૫૩૦૦૦૦૦ ૦૦	(૬) કુબત અને શકમંદ લેહણા ખાસ રિઝર્વ	૪૫૩૦૦૦૦૦ ૦૦		
૭૮૯૩૯૦૩ ૦૦	(૭) રોકાણોના ઘસારા સામે રિઝર્વ	૭૫૦૦૦૦૦ ૦૦		
—	(૮) BDDR IT (36cc) A/C	૪૫૦૦૦૦૦ ૦૦		
૧૦૦૦૦૦૦ ૦૦	(૯) Fund For Implimentation of I.T	૧૫૦૦૦૦૦ ૦૦		
૮૭૮૨૧૦ ૯૭	(અ) સહકાર પ્રચાર ફંડ	૧૧૯૭૭૦૫ ૯૭		
૫૫૦૨૦૩૩ ૧૬	(બ) ધર્માદા ફંડ	૭૧૧૬૦૧૪ ૧૬		
૩૭૨૬૭૧૮ ૩૯	(ક) ઉજવણી ફંડ	૬૧૪૭૬૯૦ ૩૯		
૨૬૩૭૯૭૫૩ ૦૦	(ડ) ઈન્વેસ્ટમેન્ટ ફલેક્સ્યુએશન ફંડ	૨૭૩૭૯૭૫૩ ૦૦		
૪૨૬૬૫૫૪ ૦૦	(ચ) સભાસદ કલ્યાણાનિધિ ફંડ	૬૫૭૯૦૨૬ ૦૦		
૭૦૦૦૦૦૦ ૦૦	(છ) BDDR (IT) FUND A/c	૭૦૦૦૦૦૦ ૦૦		
૩૫૦૦૦૦૦ ૦૦	(જ) સ્ટા.એસેટ્સ રીઝર્વ	૩૫૦૦૦૦૦ ૦૦		
	(ઝ) શિક્ષણ ફંડ ખાતે	૨૦૦૦૦૦ ૦૦		૨૦૧૫૫૯૬૫૫ ૮૮
	૩. મુખ્ય અને ગૌણ રાજ્ય ભાગીદારી ફંડ			
	૪. થાપણો અને અન્ય ખાતાં			
૧૦૮૬૪૭૫૦૪૯ ૧૪	(૧) ફિક્સ ડિપોઝીટ (મુદત થાપણો) (અ) વ્યક્તિ	૧૧૧૩૫૮૧૮૪૮ ૪૪		૧૪૧૨૫૬૫૭૪૨ ૨૨
	(બ) મધ્યસ્થ સહકારી બેન્કો			
	(ક) અન્ય મંડળીઓ			
૨૭૯૧૩૯૧૦૨ ૮૯	(૨) બચત થાપણો (અ) વ્યક્તિ	૨૬૪૧૮૭૩૬૧ ૨૦		
	(બ) મધ્યસ્થ સહકારી બેન્કો			
	(ક) અન્ય મંડળીઓ			
૩૬૭૯૨૪૬૫ ૨૫	(૩) ચાલુ થાપણો (અ) વ્યક્તિ	૩૪૭૯૬૫૩૨ ૫૮		
	(બ) મધ્યસ્થ સહકારી બેન્કો			
	(ક) અન્ય મંડળીઓ			
	૫. કરજ			
	(૧) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા/રાજ્ય/મધ્યસ્થ સહકારી બેન્કોમાંથી			
	(અ) ટુંકી મુદતની લોન/રોકડ શાખ અને ઓ.ફ્રા.			
	(બ) મધ્યમ મુદતની લોન			
૧૬૧૨૨૭૦૦૨૨ ૯૩	સરવાળો આગળ લઈ ગયા			૧૬૪૮૯૬૩૮૯૮ ૧૦

ધી લુણાવાડા પીપલ્સ કો.ઓપ. લેન્ડલી; લુણાવાડા.

૫૪ મો

પુરા થતાં વર્ષનું સરવૈયું

૩૧-૩-૨૦૨૪	મિલકત અને લેણું	રૂા	પૈસા	૩૧-૦૩-૨૦૨૫	
૩૮૫૭૬૫૧૬ ૩૨	૧. સિલક સિલક હાથ ઉપર તથા રીઝર્વ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, સ્ટેટ કો.ઓ.બેન્ક અને સેન્ટ્રલ કો.ઓ.બેન્ક			૨૬૦૦૮૦૨૪	૪૫
૬૨૮૩૭૫૧૨ ૬૩	૨. અન્ય બેન્કોમાં સિલક (૧) ચાલુ થાપણ	૫૭૦૫૨૨૧૦	૫૫		
૧૬૮૧૦૦૦૦૦ ૦૦	(૨) મુદતી થાપણ	૧૨૧૪૫૫૭૬૮	૦૦	૧૭૮૫૦૭૯૭૮	૫૫
૭૭૦૩૯૫૫૯૨ ૦૦	૩. ટૂંકી મુદત અને કોલ ખાતે રકમ ૪. રોકાણો (ઈન્વેસ્ટમેન્ટ)	૭૭૬૩૦૬૬૩૨	૦૦		
	(૧) મધ્યસ્થ અને રાજ્ય સરકારશ્રીની જામીનગીરી (૨) અન્ય ટ્રસ્ટી જામીનગીરીમાં (૩) સહકારી સંસ્થાઓના શેરોમાં નીચેની આઈટમ () સિવાય				
૫૦૦ ૦૦	ધી પંચ.જી.સહ.બેન્કના ૫૦ શેર રૂ.૧૦નો ભરપાઈ થયેલો	૫૦૦	૦૦		
૧૦૦૦૦ ૦૦	ધી જી.એચ.સી.બેન્કના શેર દરેક રૂ.૫,૦૦૦ ભરપાઈ થયેલો	૧૦૦૦૦	૦૦		
૭૫૦૦૦૦૦ ૦૦	(૪) અન્ય બધા બોન્ડ	૭૫૦૦૦૦૦	૦૦	૭૮૩૮૧૭૧૩૨	૦૦
—	૫. મુખ્ય ગૌણ રાજ્ય ભાગીદારી ફંડનું ધિરાણ ૬. ધિરાણો			૭૦૦૨૫૨૩૫૭	૩૧
૨૧૨૯૮૪૩૫૫ ૦૬	(૧) ટૂંકી મુદતની લોન કેશ કેડીટ ઓ.ડ્રા. અને બિલ્સ ડીસ્કાઉન્ટ પૈકી (અ) સરકારી જામીનગીરીના તારણ ઉપર ધિરાણો પૈકી (બ) અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ ઉપર ધિરાણો પૈકી વ્યક્તિઓ પાસે રૂ. ૨૬૪૮૩૬૯૦૪-૬૦ મુદતવીતી બાકી રૂ. ૨૯૨૩૧૮૩૭-૦૫ વસુલાત માટે દુબત અને શંકાસ્પદ ગણાય તેવું નથી.	૨૬૪૮૩૬૯૦૪	૬૦		
૧૭૯૫૨૭૯૫૬ ૨૬	(૨) મધ્યમ મુદત લોન (અ) સરકારી અને અન્ય જામીનગીરીના તારણ ઉપર (બ) અન્ય વાસ્તવિક જામીનગીરીના તારણ ઉપર વ્યક્તિઓ પાસે રૂ. ૨૬૭૪૨૯૪૯૭-૬૩ મુદતવીતી બાકી રૂ. ૩૧૨૩૩૪૦-૫૮ વસુલાત માટે દુબત અને શંકાસ્પદ ગણાય તેવું નથી.	૨૬૭૪૨૯૪૯૭	૬૩		
૧૪૩૯૯૩૨૪૩૨ ૨૭	સરવાળો આગળ લઈ ગયા			૧૬૮૮૫૮૫૪૯૨	૩૧

તા.૩૧-૩-૨૦૨૫ના રોજ

૩૧-૩-૨૦૨૪ રૂ.	પૈસા	લંડોન અને દેવું	રૂ.	પૈસા	૩૧-૦૩-૨૦૨૫
૧૬૧૨૨૭૦૦૨૨	૯૩	૧. સરવાળો આગળ લઈ આવ્યા (૨) બેન્ક ઓફ બરોડા (અ) બાંધી મુદત થાપણ સામે ઓવર ડ્રાફ્ટ (બ) મધ્યમ મુદતની લોન (ક) લાંબી મુદતની લોન (૩) અન્ય રીતે મેળવેલ લોન ૬. બિલ્સ ફોર કલેક્શન (સામી બાજુ રીસીવેબલ પ્રમાણે) ૭. શાખાના હવાલા			૧૬૪૮૯૬૩૮૯૮ ૧૦
૨૫૯૫૯૨૦૮	૪૮	૮. મુદતવીતી વ્યાજ સામે અનામત			૨૬૫૩૯૪૬૦ ૮૬
૬૬૬૬૫૪૯૧	૧૦	૯. ચુકવવા પાત્ર વ્યાજ			૬૮૪૫૫૩૫૮ ૦૦
		૧૦. અન્ય જવાબદારીઓ			
૩૭૬૩૨૦૧	૫૦	(૧) ઉપાડ ન થયેલ ડિવિડન્ડ	૭૫૨૯૮૪૮	૦૦	
૨૮૮૫૧	૦૦	(૨) શેર સરપ્લસ ખાતે	૨૯૭૧૦	૦૦	
૨૮૮૯૨૬	૭૫	(૩) સન્ટ્રી કેડીટર્સ	૨૮૮૯૨૬	૭૫	
૩૧૦૪૭૯	૦૦	(૪) T.D.S	૪૬૧૫૯૫	૦૦	
૧૦૦૦૦	૦૦	(૫) કેશ સરપ્લસ	૧૦૦૦૦	૦૦	
૧૦૬૩૦૪૧૫	૧૫	(૬) સ્ટાફ ગ્રેજ્યુઈટી ફંડ	૧૧૫૨૯૪૦૨	૦૩	
૭૩૬૪૫૭૭	૭૯	(૭) લીવ એન્કેશમેન્ટ ફંડ	૭૩૧૮૦૩૭	૪૯	
૨૪૯૨૫૦૦૦	૦૦	(૮) ઇન્કમ ટેક્સ રિટર્ન (પ્રોવિઝન)	૧૦૦૦૦૦૦૦	૦૦	
૩૦૦૦૦	૦૦	(૯) Income tax return fee pro	૩૦૦૦૦	૦૦	
૪૧૦૦૦	૦૦	(૧૦) Audit Fees payable A/c	૧૩૩૨૮૦	૦૦	
૩૦૦૦૦	૦૦	(૧૧) Tax Audit Fees payable A/c	૩૦૦૦૦	૦૦	
૬૩૯૦૫૨	૦૦	(૧૨) Closing Allow. payable A/c	૭૩૮૭૧૫	૦૦	
૫૦૦૦૦	૦૦	(૧૩) Income tax legal fee pro			
૬૬૬૮૨	૦૭	(૧૪) CGST payable A/c	૧૦૭૨૨૩	૧૦	
૬૬૬૮૨	૦૭	(૧૫) SGST payable A/c	૧૭૦૨૨૩	૧૦	
૮૧૩	૫૯	(૧૬) IGST payable A/c	૧૨૫૩	૨૦	
		(૧૭) VAPT Audit payable	૫૫૦૦૦	૦૦	
		(૧૮) એડહેસીવ સ્ટેમ્પ ફેન્ડીંગ	૭૮૭૯	૦૦	૩૮૩૭૮૦૯૨ ૬૭
		(૧૯) નફો - નુકશાન			
૨૦૨૪૩૩૮૯	૨૫	પાછલા વર્ષના સરવૈયા મુજબ	૨૩૯૧૬૧૧૯	૭૩	
૨૦૨૪૩૩૮૯	૨૫	બાદ : વહેંચણી	૨૩૯૧૬૧૧૯	૭૩	
૨૩૯૧૬૧૧૯	૭૩	ઉમેરો : નફા- નુકશાન ખાતે મેળવેલ નફો			૧૮૮૫૬૫૫૨ ૦૦
૧૭૭૭૦૫૬૫૨૩	૧૬	કુલ સરવાળો			૧૮૦૧૧૯૩૩૬૧ ૬૩

(૧૧) આકસ્મિક જવાબદારીઓ કેફ લાયાબીલીટીઝ ડિપોઝીટ

એકાઉન્ટ (૬૪૦૩૪૬૪-૪૩)

પાછલા વર્ષના (૬૩૩૧૮૩૯-૨૭)

Notes on Accounts, Forming Parts of Accounts - Annexure I & II

શ્રી રજનીકાન્ત વી. ગાંધી

ચેરમેન શ્રી

ડૉ. શ્રી પ્રકાશભાઈ કે.દોશી

મેનેજિંગ ડિરેક્ટરશ્રી

ડીરેક્ટરશ્રી

શ્રી રમેશચંદ્ર રમણલાલ પટેલીયા

શ્રી હેતલકુમાર કૃષ્ણપ્રસાદ દોશી

શ્રી વિપુલકુમાર રજનીકાંત શાહ

શ્રી રાજેશભાઈ વી. દોશી

શ્રી જીતેનભાઈ વી. દોશી

શ્રી મયુરભાઈ સી.શાહ

શ્રીમતિ એશાબેન ડી. દોશી

ઇશિતાબેન એમ. ગાંધી

શ્રી જ્યંતિલાલ મગનલાલ દોશી

શ્રીમતી મમતાબેન શૈલેન્દ્રભાઈ શાહ, પ્રો.ડીરેક્ટર

શ્રી દિપભાઈ પી. દોશી, પ્રો.ડીરેક્ટર

શ્રી હેમંતભાઈ જે. દોશી

શ્રી ધારીનભાઈ નીલેશભાઈ ગાંધી

ધી લુણાવાડા પીપલ્સ કો.ઓપ. લેન્ડલી; લુણાવાડા.

પ૪મો

તા.૩૧-૩-૨૦૨૫ ના રોજ

૩૧-૩-૨૦૨૪					૩૧-૦૩-૨૦૨૫	
ક્ર.	પૈસા	ખર્ચ	ક્ર.	પૈસા	ક્ર.	પૈસા
૭૬૯૫૨૫૭૫	૬૬	(૧) થાપણો કર્જ વિ.ઉપરનું વ્યાજ			૮૮૦૫૩૩૩૮	૯૬
૧૩૭૪૩૮૦૬	૪૧	(૨) પગાર ભથ્થા અને સ્ટાફ પ્રો. ફંડ ફાળો			૧૩૬૦૫૩૭૭	૭૦
		(૩) કાયરેક્ટર્સ તથા સ્થા.કમિટીના સભ્યોની ફી તથા ભથ્થા				
૨૦૬૩૫૬૩	૧૯	(૪) ભાડુ, કર, વિજળી, વીમો G.S.T વિગેરે			૨૦૬૫૦૮૦	૬૩
૨૨૦૦૦	૦૦	(૫) વકીલ ફી			૫૪૫૦૦	૦૦
૭૮૬૧	૩૦	(૬) તાર-ટપાલ ખર્ચ			૧૦૨૪૫	૦૦
૧૭૧૦૦૦	૦૦	(૭) ઓડીટ ફી			૨૮૨૨૮૦	૦૦
૩૭૪૦૦૧	૦૦	(૮) મિલ્કત ઘસારા અને મરામત ખર્ચ			૩૩૮૨૧૮	૦૦
		(૯) બિન બેન્કિંગ અસ્કયામતોના વેચાણ				
		લેવડ -દેવડમાં આવેલ ખોટ				
૨૬૫૨૭૮	૧૬	(૧૦) સ્ટેશનરી છાપકામ, જાહેરાત ખર્ચ			૧૭૮૭૮૦	૭૨
		(૧૧) અન્ય ખર્ચ			૨૦૨૯૦૯૯	૪૮
૨૬૬૦૦	૦૦	(૧) સહકારી સંસ્થાઓની ફી	૧૫૦૦	૦૦		
૨૩૩૩૫૭	૧૮	(૨) પરચુરણ ખર્ચ	૩૦૫૯૩૨	૪૬		
૯૧૪૮૧	૪૩	(૩) એસ.એમ.એસ સર્વિસ ચાર્જ	૭૩૬૧૦	૧૩		
૪૪૦૧૪	૦૦	(૪) મુસાફરી ખર્ચ	૪૫૧૮૫	૦૦		
૨૧૭૧૧૩	૬૯	(૫) એ.એમ.સી.ચાર્જીસ	૨૮૮૪૮૯	૭૩		
૨૧૮૩૩	૫૧	(૬) NPCI/NACH/ACH Charges debit A/C	૪૫૬૫૩	૫૭		
૫૧૦	૦૦	(૭) કોમ્પ્યુટર રીપેરીંગ ખર્ચ				
૨૦૦૦	૦૦	(૮) Renewal charges A/c				
૩૮૦૧૪૫	૦૦	(૯) પ્રિમીયમ એમોર્ટાઇઝેશન જોગવાઈ				
૧૭૮૧૬૩૨	૦૫	(૧૦) સ્ટાફ ગ્રેજ્યુઇટી	૨૪૧૬૬૮૬	૮૮		
૧૭૫૦	૦૦	(૧૧) SGL charges paid	૩૨૫૦	૦૦		
૧૦૦૮૧	૧૫	(૧૨) CIC Report Charges	૬૦૭૬	૬૧		
૯૪૧૩	૦૦	(૧૩) ટેલીફોન ચાર્જીસ	૫૧૯૨	૦૦		
૧૫૦૦૦	૦૦	(૧૪) ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની ફી	૧૦૦૦૦	૦૦		
૪૧૪૪૮૪	૦૦	(૧૫) પ્રોફેશનલ એન્ડ કન્સલ્ટન્સી ફી	૪૬૦૦૦	૦૦		
૨૫૩૯	૮૦	(૧૬) Fire Extinguisher A/C	૨૬૩૯	૮૦		
૩૫૩૪૪	૦૦	(૧૭) એન્યુઅલ જનરલ મીટીંગ ખર્ચ	૩૯૩૮૨	૦૦		
૪૦૦૦૦૦૦	૦૦	(૧૮) ખરાબ અને શકમંદ લેણાં				
૫૦૦૦૦૦	૦૦	(૧૯) સ્ટાન્ડર્ડ એસેટ્સ પ્રોવિઝન				
૨૬૮૨૦	૦૦	(૨૦) Ribbion Exp.A/c	૨૮૪૧૧	૮૪		

તપાસ્યું છે અને બરાબર માલુમ પડેલ છે આજ તારીખના અમારા ઓડીટ રીપોર્ટને આધિન.

લુણાવાડા

તા.૧૫-૫-૨૦૨૫

એસ.એમ. દોશી
MANAGER/CEO

પી. એચ. દોશી
કન્સલ્ટન્ટ ઓડીટર

M/S JOSHI PATEL & BHATT CO.
PAN NO.VAD/FIRM/154
FRN NO. 135582W
RBIUCN NO :953537

ધી લુણાવાડા પીપલ્સ કો.ઓપ. લેન્ડલી; લુણાવાડા.

પ૪ મો

પુરા થતા વર્ષનું નફા-નુકશાન ખાતું

૩૧-૩-૨૦૨૪		રૂ.	પૈસા	૩૧-૦૩-૨૦૨૫
રૂ. પૈસા	આવક			રૂ. પૈસા
૧૩૩૩૮૦૬૧૦ ૩૪	(૧) વ્યાજ અને વટાવ			૧૪૨૨૧૪૧૫૪ ૨૧
૫૮૨૩૭ ૩૨	(૨) કમીશન			૫૧૧૭૬ ૬૬
—	(૩) સહાય			—
—	(૪) બિન બેન્કીંગ અસ્કયામતોની વહેંચણીમાંથી મળેલો નફો			—
૨૦૫૪ ૦૦	(૫) અન્ય આવક			૪૩૮૮૧૫ ૬૨
૭૩૩૦ ૦૦	(૧) શેર ટ્રાન્સફર ફી	૫૩૫ ૦૦		
૧૩૮૬૨૮ ૬૬	(૨) વારસ ફી	—		
૧૬૨૮ ૦૦	(૩) નામધારી સભાસદ ફી	૭૩૭૦ ૦૦		
—	(૪) લોકર્સ ભાડું	૧૭૭૯૬૨ ૬૪		
૧૪૦૫૬૦ ૨૫	(૫) કુપ્લીકેટ શેર/ડી.વી. ઇસ્યુ ફી	૧૪૪૩ ૦૦		
૯૮૮૬ ૦૬	(૬) રોકાણોમાંથી મેળવેલ નફો	—		
૧૨૦૯૦ ૦૦	(૭) ચેક બુક ઇસ્યુ રીટર્ન ચાર્જીસ	૧૬૪૦૫૨ ૭૭		
—	(૮) અન્ય આવક	૨૬૦૦ ૬૮		
૬૯૫૫ ૫૦	(૯) નોટીસ ચાર્જ	૧૦૪૯૫ ૦૦		
૩૬૮૯૫ ૦૯	(૧૦) સી.આઈ.સી. રીપોર્ટ ચાર્જીસ	૫૫૦૦ ૦૦		
	(૧૧) રીબીન સર્વિસ આવક	૩૩૨૬૫ ૬૭		
	(૧૨) ડીફેક્ટ ટેક્સ લાય.પરત			
	(૧૩) ATM/MC CHARGES AC	૩૫૫૯૦ ૮૬		
૪૦૮૫૦ ૦૦	(૬) ઇન્કમેટેક્સ રીફંડ			૯૮૨૦ ૦૦
૫૨૦૦૦૦૦ ૦૦	(૭) આઈ.ડી.આર પ્રોવિઝન પરત			
૩૯૨૦૧૭ ૫૦	(૮) (૧) Profit From Investment			૨૨૪૦૦૦ ૦૦
	(૯) INCOME TAX PROVISION RETURNED			૭૯૭૩૯૮ ૦૦
૧૩૯૪૨૭૭૭૪ ૭૨	કુલ સરવાળો			૧૪૩૭૩૫૩૬૪ ૪૯

શ્રી રજનીકાન્ત વી. ગાંધી
ચેરમેન શ્રી

ડીરેક્ટર્સ

શ્રી રમેશચંદ્ર રમણલાલ પટેલીયા
શ્રી હેતલકુમાર કૃષ્ણપ્રસાદ દોશી
શ્રી વિપુલકુમાર રજનીકાન્ત શાહ
શ્રી રાજેશભાઈ વી. દોશી
શ્રી જીતેનભાઈ વી. દોશી
શ્રી મયુરભાઈ સી.શાહ

ડૉ. શ્રી પ્રકાશભાઈ કે.દોશી
મેનેજિંગ ડિરેક્ટરશ્રી

ડીરેક્ટર્સ

શ્રીમતિ એશાબેન ડી. દોશી
શ્રીમતિ ઇશિતાબેન એમ. ગાંધી
શ્રી જયંતિલાલ મગનલાલ દોશી
શ્રીમતી મમતાબેન શૈલેન્દ્રભાઈ શાહ, પ્રો.ડીરેક્ટર
શ્રી દિપભાઈ પી. દોશી, પ્રો.ડીરેક્ટર
શ્રી હેમંતભાઈ જે. દોશી
શ્રી ધારીનભાઈ નીલેશભાઈ ગાંધી

૩૧-૩-૨૦૨૪		૩૧-૦૩-૨૦૨૫				
રૂ.	પૈસા	ખર્ચ	રૂ.	પૈસા	રૂ.	પૈસા
૯૧૨૫૦૦૦	૦૦	(૨૧) ઇન્કમેટેક્સ ખાતે	૧૧૧૫૫૦૦૦	૦૦		
૧૮૨૧૬	૦૦	(૨૨) કેશ હેન્ડલીંગ ચાર્જ	૨૩૬૦	૦૦		
૯૦૦૦૦	૦૦	(૨૩) CBS મેઇન્ટેનન્સ ચાર્જ	૬૩૦૦૦	૦૦		
૧૩૩૦૦૦	૦૦	(૨૪) IMPS પ્રોવિઝન A/C				
		(૨૫) ATM Service charges A/c	૨૩૪૦૦	૦૦		
૫૦૦૦૦૦	૦૦	(૨૬) Funt For Impli. IT A/c	૫૦૦૦૦૦	૦૦		
૪૫૯૬	૯૩	(૨૭) Rupay card charges A/c	૮૯૩૧૦	૦૦		
૧૦૨૩૧૯	૬૬	(૨૮) Fund managment charges (LIC)	૫૬૦૮૩	૮૭		
૨૬૫૦૦	૦૦	(૨૯) Certi.ISSUE Charge				
૩૦૦૦	૦૦	(૩૦) LEI Registration charges A/c	૭૯૫૦	૦૦		
		(૩૧) RBI penlaty A/c				
૨૧૦૫૮૩	૪૭	(૩૨) મોબાઇલ ટ્રાન્સકેસન ચાર્જીસ	૩૫૨૧૫૦	૨૦		
		(૩૩) Training exp. A/c	૫૯૦૯	૦૦		
૫૪૩	૪૫	(૩૪) NDS call trading charge	૨૧૭૦	૬૮		
		(૩૫) Investment Depri. pro A/c				
૩૫૦૦૦૦૦	૦૦	(૩૬) BDDR (IT) prorision A/c	૪૫૦૦૦૦૦	૦૦		
૧૧૪૩૦૦	૦૦	(૩૭) Locker Agreement Exp.	૧૨૯૦૦	૦૦		
૭૬૧	૩૯	(૩૮) Demant charges				
૩૮૫૦૦	૦૦	(૩૯) Anti Virus Renew fee				
૬૯૯૧	૫૬	(૪૦) Service charges A/c				
૧૩૯૧૦૬	૦૦	(૪૧) Member medical relief Exp.				
૪૦૦૦	૦૦	(૪૨) Software service charges	૧૩૧૧૮	૬૬		
૫૦૦૦૦	૦૦	(૪૩) Income tax Legal fee exp.				
૩૦૦૦૦	૦૦	(૪૪) Income tax return fee exp.A/c	૩૦૦૦૦	૦૦		
		(૪૫) Qr Code Charges A/c.	૮૯૩૭૪	૫૭		
		(૪૬) Beneficiary Lookup Service Charges A/c.	૭૦૦૦૦	૦૦		
		(૪૭) Franking License Renew Fee A/c.	૨૫૪	૪૮		
૨૩૯૧૬૧૧૯	૭૩	(૧૨) ચાલુ વર્ષનો નફો			૧૮૮૫૬૫૫૨	૦૦
૧૩૯૪૨૭૭૪૨	૭૨	કુલ સરવાળો			૧૪૩૭૩૫૩૬૪	૪૯

તપાસ્યું છે અને બરાબર માલુમ પડેલ છે આજ તારીખના અમારા ઓડીટ રીપોર્ટને આધિન.

લુણાવાડા

તા.૧૫-૫-૨૦૨૫

એસ.એમ. દોશી
MANAGER/CEO

પી. એચ. દોશી
ફન્કરન્ટ ઓડીટર

M/S JOSHI PATEL & BHATT CO.
PAN NO.VAD/FIRM/154
FRN NO. 135582W
RBIUCN NO :953537

પ૪ મો

31-3-2024	આવક	31-03-2024
સરવાળો આગળ લાવ્યા		
૧૩૯૪૨૭૭૭૪-૭૨		૧૪૩૭૩૫૩૬૪-૪૯
૧૩૯૪૨૭૭૭૪-૭૨	કુલ સરવાળો	૧૪૩૭૩૫૩૬૪-૪૯

M/S JOSHI PATEL & BHATT CO.
PAN NO.VAD/FIRM/154
FRN NO. 135582W
RBIUCN NO :953537

એકાઉન્ટીંગ પોલિસી (હિસાબી નીતિઓ)

- (૧) બેંકે તેના હિસાબો સામાન્ય રીતે માન્ય વ્યાપારિક પદ્ધતિ (મર્કેન્ટાઇલ સીસ્ટમ) પ્રમાણે તૈયાર કરેલ છે. અને તે હિસ્ટોરીકલ કોસ્ટ પદ્ધતિ (Historical Cost Convention) અને બેંકીંગ વ્યવસાય ચાલુ/ અસ્તિત્વમાં રહેશે (Going Concern) તે ખ્યાલને નજર સમક્ષ રાખીને તૈયાર કરેલ છે. બેંકના વ્યાજ સહિતના ખર્ચાઓ કે જે વર્ષના આખરે ચુકવવા પાત્ર હતા અને વ્યાજબી રીતે નક્કી કરી શકાય તેમ હોય, તેની જોગવાઈઓ કરવામાં આવે છે. જ્યારે વ્યાજબી આવક પણ વ્યાપારી પદ્ધતિ પ્રમાણે ગણતરી કરી ચઢત વ્યાજને આવક તરીકે ગણવામાં આવેલ છે. પરંતુ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા/ સુચના મુજબ નોન પરફોર્મિંગ ધિરાણ પરનું વ્યાજ જ્યારે વસુલાત થાય ત્યારે જ જમા લેવામાં આવે છે.
- (૨) આવક તથા ખર્ચને લગતી એકાઉન્ટીંગ પોલિસી :
- (૧) આવક : - વ્યાજ તથા બીજી આવકો સામાન્ય રીતે ચઢત થાય ત્યારે ગણતરીમાં લેવામાં આવે છે, પરંતુ નીચેની બાબતો ખરેખર વસુલાત આવે ત્યારે જ ગણતરીમાં લેવામાં આવે છે.
૧. કમીશન તથા એક્સચેન્જ (વટાવ)
 ૨. ડિવીડન્ડ
 ૩. નોન પરફોર્મિંગ એસેટ પર ચઢત વ્યાજ
 ૪. પરચુરણ આવકો જેવી કે, શેર ટ્રાન્સફર ફી, કુપ્લીકેશન ફી વગેરે
- (૨) ખર્ચા : - વ્યાજ તથા બીજા ખર્ચાઓની ગણતરી સામાન્ય રીતે ચઢત ધોરણે કરવામાં આવે છે. જોકે નીચે દર્શાવેલ બાબતો જ્યારે ચુકવણું થાય ત્યારે જ ગણતરીમાં લેવામાં આવે છે.
૧. મુસાફરી ખર્ચ
 ૨. ટેલીફોન ખર્ચ
 ૩. વિજળી બીલ ખર્ચ
 ૪. લવાજમ ખર્ચ તથા એસોસીએશન ફી વગેરે
 ૫. મકાન બિલ્ડીંગ મ્યુનિસિપલ વેરો
 ૬. હક રજાનો પગાર વગેરે
- (૩) ઉપર મુજબના આવક તથા ખર્ચા વગેરેને ચઢત ધોરણે ધ્યાનમાં લેતી વખતે મટીરીયાલીટી કોન્સેપ્ટને પણ ધ્યાનમાં લેવામાં આવેલ છે.
- (૪) બેંકની મિલ્કતોનું વાર્ષિક વીમા પ્રિમીયમ, જ્યારે ભરવામાં આવે છે ત્યારે જ ઉધારવામાં આવે છે.
- (૫) ધિરાણ તથા રોકાણોના વ્યાજને તેમજ ડિપોઝીટ તથા કરજ ઉપરના વ્યાજને તેના સમયના પ્રમાણમાં ધ્યાનમાં લેવામાં આવે છે.
- (૩) બેંકના રોકાણો : -
૧. બેંકના રોકાણોને સરવૈયામાં નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલ છે.
 - અ. કેન્દ્ર તથા રાજ્ય સરકારની જામીનગીરીઓ, ટ્રેઝરી બીલ (RBI)
 - બ. માન્ય ટ્રસ્ટી જામીનગીરીઓ
 - ક. સહકારી સંસ્થાના શેર્સ
 - ડ. જી એસ. એફ.સી શેર્સ
 - ઇ. અન્ય રોકાણો (PSU/UTI વગેરે)
 ૨. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ સરકારી જામીનગીરીઓને (SLR) બે વિભાગમાં વર્ગીકરણ કરવાનું હોય છે. તે મુજબ બેંકે તા. ૩૧/૦૩/૨૦૨૫ ના રોજ નીચે પ્રમાણેનું વર્ગીકરણ કરેલ છે.

	વિગત	રૂા.લાખમાં(B.V)	રૂા.લાખમાં (F.V)
૧	હેલ્ડ ટુ મેચ્યુરીટી	૧૮૬૪.૦૭	૧૮૭૭.૦૦
૨	અવેલેબલ ફોર સેલ	૫૮૯૯.૦૦	૫૯૦૬.૩૦
૩	હેલ્ડ ફોર ટ્રેડીંગ		
૪	ટ્રેઝરી બીલ (RBI) A.F.S		
	કુલ રૂા.	૭૭૬૩.૦૭	૭૭૮૩.૩૦

૩. સરવૈયામાં સરકારી જમીનગીરી (SLR) ના રોકાણો, પડતર કિંમતે દર્શાવવામાં આવેલ છે સીક્યુરીટીઝ ઉપર ચુકવેલ પ્રિમીયમ કે જે પાકતી મુદત સુધીના સમય માટે માંડવાળ કરવાનું બાકી રહેલ છે.
૪. સરકારી જમીનગીરી હેલ્ડ ટુ મેચ્યુરીટી (HTM) વર્ગીકૃત છે. તે અન્વયે સદર રોકાણોને તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ માર્ક ટુ માર્કેટને ધ્યાનમાં ન લેવાના હોવાથી આ અંગે બેંકે કોઈપણ પ્રોવિઝન કરવાનું રહેતું નથી. પરંતુ (AFS) ના રોકાણો ને માર્ક ટુ માર્કેટ ધોરણે ધ્યાનમાં લેતા આ અંગેનું કોઈ પ્રોવિઝન કરવાનું થતું નથી. બેન્ક પાસે આ અંગેનું પુરતું પ્રોવીઝન છે.
૫. Non-SLR રોકાણો અંતર્ગત રૂા. ૭૫.૦૦ લાખનું પ્રોવીઝન કરવાનું થાય છે. તે પેટે બેન્કે પુરતું પ્રોવીઝન કરેલ છે.

(૪) ધિરાણો : રીઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, બેન્કના ધિરાણોને ઉપજાઉ તેમજ બીન ઉપજાઉ ધિરાણોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. બીન ઉપજાઉ ધિરાણોને સબ-સ્ટાન્ડર્ડ ધિરાણો, ખરાબ અને શંકાસ્પદ ધિરાણો તેમજ નુકશાની ધિરાણોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. અને આ અંગેનું જરૂરી એવું પુરતું પ્રોવિઝન કરવામાં આવેલ છે.

(૫) કર્મચારીઓના નિવૃત્તિ લાભો :

તા. ૩૧/૦૩/૨૦૨૫ ના પુરા થતા વર્ષ સુધી બેંકે કર્મચારીઓના લાભો અંગે નીચે મુજબની જોગવાઈઓ કરેલ છે.

	વિગત	કરવાપાત્ર જોગવાઈ રૂા. લાખમાં	કરેલ જોગવાઈ રૂા. લાખમાં
૧	હક રજા લાભ	૭૩.૧૮	૭૩.૧૮
૨	ગ્રેજ્યુઈટી લાભ	૧૦૦.૨૯	૧૧૫.૨૯

- (૬) સ્ટાફ પ્રોવિડંટ ફંડ LIC સાથે જોડાણ કરેલ છે અને તમામ કપાત LIC માં રોકાણ થાય છે.
- (૭) સ્થાયી મિલ્કતો : બેન્કે સ્થાયી મિલ્કતોની કિંમત મૂળ કિંમતમાંથી વર્ષોવર્ષ જરૂરી એવો ઘસારો બાદ કર્યા પછીની કિંમતે દર્શાવેલ છે. બેન્કે વર્ષ દરમિયાન તેની કોઈપણ મિલ્કતોનું ફરીથી મૂલ્યાંકન કરીને તેની ચોપડાની કિંમતોમાં વધારો કે ઘટાડો કરેલ નથી.
- (૮) એક્ઝાઉન્ટીંગ સ્ટાન્ડર્ડસ :
- બેંકને લાગુ પડતા એક્ઝાઉન્ટીંગ સ્ટાન્ડર્ડસનું પાલન કરવામાં આવેલ છે. જેનો વિગતવાર ઉલ્લેખ સામાન્ય શેરા ભાગ - ૨ માં કરવામાં આવેલ છે.
- (૯) કન્ટીજન્ટ જવાબદારી અને કન્ટીજન્ટ મિલ્કતો-જોગવાઈ :
- તારીખ : ૩૧/૦૩/૨૦૨૫ ના રોજ આકસ્મિક જવાબદારી તથા કન્ટીજન્ટ મિલ્કતો 0 છે. જેથી જોગવાઈ કરવાની રહેતી નથી.

(૧૦) ટેક્ષેશન :

- SGST / GST દર માસે નિયમિત રીતે રીટર્ન ભરવામાં આવે છે તેમજ Electronic Ledger સાથે મેળવણી કરવાની રહે છે.
- બેંકમાં TDS Deducted તેમજ એડવાન્સ ટેક્ષ ભરેલ તે સરવૈયામાં મિલ્કત બાજુએ લેણાં તરીકે દર્શાવવામાં આવે છે અને ઇન્કમેટેક્સ અંગેની જોગવાઈ જવાબદારી તરીકે જ્યાં સુધી ઇન્કમેટેક્સના ઓર્ડરની કાર્યવાહી પુરી ન થાય ત્યાં સુધી દર્શાવવામાં આવે છે.

(૧૧) રીઝર્વ ફંડ અને અન્ય રીઝર્વ :

ધી ગુજરાત સહકારી એક્ટ-૧૯૬૧ રીઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ તથા સંસ્થાના પેટા-નિયમોની જોગવાઈઓને આધીન સામાન્ય સભામાં નફાની ફાળવણી કરવામાં આવે છે અને તે પ્રમાણે આ તમામ ફંડો સરવૈયા માં દર્શાવેલ છે.

(૧૨) ચોખ્ખો નફો :

ઓડીટ સમયમાં ચોખ્ખો નફો રૂ. ૧૮૮૫૬૫૫૨-૦૦ થયેલ છે જે નીચે પ્રમાણેની જોગવાઈઓ બાદ કરતા દર્શાવેલ છે.

- BDDR (IT) PROVISION A/C	રૂ ૧.	૪૫૦૦૦૦૦-૦૦
- FUNO FOR I.T IMPLIMATION	રૂ ૧.	૫૦૦૦૦૦-૦૦
	રૂ ૧.	૫૦૦૦૦૦૦-૦૦

ખાસ નોંધ :- ઉપરોક્ત જોગવાઈઓ બાદ કર્યા પછી જ ચોખ્ખો નફો દર્શાવેલ છે.

તારીખ : ૧૫-૫-૨૦૨૫

સ્થળ : લુણાવાડા

M/S JOSHI PATEL & BHATT CO.

PAN NO.VAD/FIRM/154

FRN NO. 135382W

RBIUCN NO :953537

Mandatory Disclosures in terms of circular

Dor.Acc.REC.No. 45/21.04.018/2021

No. RBI/DOR/2021-22/83,
on August 30,2021

Annexure - I

Regulatory Capital

a) Composition of Regulatory Capital

Sr. No.	Particulars	Current Year 31.3.25	Previous Year 31.03.24
i)	Common Equity Tier 1 capital (CET 1)* / Paid up share capital and reserves [@] (net of deductions, if any)	3.48	3.25
ii)	Additional Tier 1 capital* / Other Tier 1 capital [@]	10.25	5.65
iii)	Tier 1 capital (i + ii)	13.73	8.90
iv)	Tier 2 capital	3.26	3.10
v)	Total capital (Tier 1 + Tier 2)	16.99	12.00
vi)	Total Risk Weighted Assets (RWAs)	69.51	61.39
vii)	CET 1 Ratio (CET 1 as a percentage of RWAs)* / Paid-up share capital and reserves as percentage of RWAs [@]	0.00	0.00
viii)	Tier 1 Ratio (Tier 1 capital as a percentage of RWAs)	19.75 %	14.49%
ix)	Tier 2 Ratio (Tier 2 capital as a percentage of RWAs)	4.70 %	5.06%
x)	Capital to Risk Weighted Assets Ratio (CRAR) (Total Capital as a percentage of RWAs)	24.45%	19.55%
xi)	Leverage ratio*	-	-
xii)	Percentage of the shareholding of a) Government of India b) State Government (specify name) ^s c) Sponsor Bank ^s	-	-
xiii)	Amount of paid-up equity capital raised during the year	-	-
xiv)	Amount of non equity Tier 1 capital raised during the year, of which : Give list ⁷ as per instrument type (perpetual non-cumulative preference shares, perpetual debt instruments, etc.). Commercial banks (excluding RRBs) shall also specify if the instruments are Basel II or Basel III compliant.	-	-
xv)	Amount of Tier 2 capital raised during the year, of which : Give list ⁸ as per instrument type (perpetual non-cumulative preference shares, perpetual debt instruments, etc.). Commercial banks (excluding RRBs) shall also specify if the instruments are Basel II or Basel III compliant.	-	-

No. RBI/DOR/2021-22/83,
on August 30, 2021

Annexure - 2

Asset Liability management

	Day 1	2 to 7 days	8 to 14 days	15 to 30 days	31 days to 2 months	Over 2 months and to 3 months	Over 3 months and up to 6 months	Over 6 months and up to 1 year	Over 1 year and up to 3 years	Over 3 year and up to 5 years	Over 5 years	Total
Deposits		-	14.52	4.78	-	13.68	23.67	19.72	64.20	-	0.01	140.58
Advances	0.00	0.00	5.33	0.97	0.00	7.93	12.05	24.18	7.40	3.72	0.52	62.10
Investments	0.00	0.00	2.05	0.00	0.00	5.97	9.06	7.32	9.36	9.86	47.25	90.87
Borrowings	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Foreign Currency assets	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Foreign Currency liabilities	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00

3. INVESTMENTS

Annexure - 3 (a)

a) Composition of Investment Portfolio as at 31/03/2025 (current Year Balance Sheet Date)
(Amt.in Crore)

		Invetments in India						Invetments outside India				Total Invest-ments	
		Government Securities	Other Approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and/or Joint Ventures	Others	Total Invest-ments in India	Government Securities	Subsidiaries and/or Joint Ventures	Others		Total Invest-ments in India
Held to Maturity													
Gross		18.64	0.00	0.00	0.75	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	19.39
Less : Provision for Non-Performing Investment (NPI)		0.00	0.00	0.00	0.75	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.75
Net		18.64	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	18.64
Available for Sale													
Gross		58.99	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	58.99
Less : Provision for Depreciaton and NPI		0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Net		58.99	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	18.99
Held For Trading													
Gross													
Less : Provision for Depreciaton and NPI													
Net													
Total Investmnts		77.63	0.00	0.00	0.75	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	78.38
Less : Provision for Non-Performing		0.00	0.00	0.00	0.75	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.75
Less : Provision for Depreciaton		0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Net		77.63	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	77.63

Annexure - 3 (b)

Movement of Provision for Depreciation and Investment Fluctuation Reserve
(Amt.in Crore)

Particulars	Current Year	Previous Year
i) Movement of Provisions held towards depreciation on Investments	0.04	0.54
a) Opening Balance	0.04	0.02
b) Add : Provision made during the Year	0.08	52.00
c) Less : Write off/ Write back of excess provisions During the Year	0.00	0.04
d) Closing Balance		
ii) Movement of Investment Fluctuation Reserve		
a) Opening Balance	2.64	2.34
b) Add : Amount Transferred during the Year	0.10	0.30
c) Less : Drawdown	-	-
d) Closing Balance	2.74	2.64
iii) Closing Balance in IFR as a Percentage of Closing Balance of Investments in AFS and HFT / Current Category	3.53%	4.84%

Annexure - 3 (c)

3.d. NoN-SLR INVESTMENT PORTFOLIO

i) Non-Performing Non-SLR Investments

(Amt.in Crore)

Sr.no.	Particulars	Current Year	Previous Year
a)	Opening Balance	0.75	0.75
b)	Additions during the Year since 1st April	-	0.00
c)	Reduction during the Year	-	0.00
d)	Closing Balance	0.75	0.75
e)	Total Provision Held	0.75	0.75

ii) Issuer composition of Non-SLR Investments

(Amt.in Crore)

Sr.no.	Issuer	Amount		Extent of PVT Placement		Extent of Below Invst. Grade Securities		Extent of Unrated Securities		Extent of Unlisted Securities	
		Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
a)	PSUs	0.75	0.75	0	0	0	0	0	0	0	0
b)	FIs	0.00	0.00	0	0	0	0	0	0	0	0
c)	Banks	12.15	16.81	0	0	0	0	0	0	0	0
d)	Pvt Corporates	0.00	0.00	0	0	0	0	0	0	0	0
e)	Subsidiaries/ Joint Ventures			0	0	0	0	0	0	0	0
f)	Others	0.00	0.00	0	0	0	0	0	0	0	0
g)	Provision Helds Towards Depreciation	0.75	0.75	0	0	0	0	0	0	0	0
	Total	12.15	16.81	0	0	0	0	0	0	0	0

Annexure - 4(a)

4. ASSET QUALITY

a) Classification of Advances and Provisions Held

	Standard	Non-Performing				Total Advances
	Total Standard Advances	Sub-Standard	Doubtful	Loss	Total NPA	
Gross Standard Advances and NPAs	55.20	1.81	2.39	0.88	5.08	60.28
Opening Balance			-		-	-
Add : Addition During the Year	10.90	0.93	-	-	-	9.74
Less : Reductions during the Year	-	-	0.13	0.10	1.16	-
Closing Balance	66.10	0.88	2.26	0.78	3.92	70.02
* Reductions in Gross NPAs due to :						
i) Upgradation						
ii) Recoveries (Excluding upgradation)						
iii) Technical / Prudential Write-offs						
iv) Write-offs other than under (iii)						
Provisions (Excluding Floating Provisions)						
Opening Balance						
Add : Fresh Provisions made during Year						
Less : Excess Provision reversed / Write-off loans						
Closing Balance of Provision held						
Net NPAs						
Opening Balance						
Add : Fresh additions during Year						
Less : Reduction during year						
Closing Balance						
Floating Provisions						
Opening Balance						
Add : Additional Provisions made during Year						
Less : Amount drawn down during year						
Closing Balance of Floating Provision held						
Technical Write-offs and recoveries made thereon						
Opening balance of Tech / Prudential Written-off A/Cs						
Add : Tech / Prudential Written-offs during year						
Less : Recoveries made from Previously Tech/Prudential Written-off A/Cs during year						
Closing Balance						
Ratios (in%)	Current Year	Previous Year				
Gross NPA to Gross Advances	5.60%	0.00%	8.43%	0.00%		
Net NPA to Net Advances	0.00%	0.00%	0.00%	0.00%		
Provision Coverage Ratio	115.52%	0.00%	145.08%	0.00%		

provision for 2023/24 rs. 7.38cr

provision for 2022/23 rs. 4.81cr

Annexure - 4(b)

4. ASSET QUALITY

b) Sector-wise Advances and gross NPAs

(Amt.in Crore)

Sr. No.	Sector*	Current Year			Previous Year		
		Outstanding Total Advances	Gross NPAs	% of Gross NPAs to Total Advances in that Sector	Outstanding Total Advances	Gross NPAs	% of Gross NPAs to Total Advances in that Sector
i)	Priority Sector						
a)	Agriculture and Allies Activities	0	0.00	0.00	0	0.00	0.00
b)	Advances to industries eligible as priority Sector lending	0	0.00	0.00	0	0.00	0.00
c)	Services	0	0.00	0.00	0	0.00	0.00
d)	Personal Loans	61.54	3.04	4.34	55.97	4.92	8.16
	Sub-Total (i)	61.54	3.04	4.34	55.97	4.92	8.16
ii)	Non-Priority Sector						
a)	Agriculture and Allies Activities	0	0.00	0.00	0	0.00	0.00
b)	Industry	0	0.00	0.00	0	0.00	0.00
c)	Services	0	0.00	0.00	0	0.00	0.00
d)	Personal Loans	8.48	0.88	1.26	4.31	0.16	0.27
	Sub-Total (ii)	8.48	0.88	1.26	4.31	0.16	0.27
	Total (i+II)	70.02	3.92	5.60%	60.28	5.08	8.43%

*Banks Shall also disclosed sub-sector where the outstanding advances exceeds 10 percent of Total Advances

Annexure - 4 (c)

*Particulars of resolution plan and restructuring
ii) Details of accounts subjected to restructuring*

		Agriculture and allied activities		Corporates (excluding MSME)		Micro, Small and Medium Enterprises (MSME)		Retail (excluding agriculture and MSME)		Total	
		Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
Standard	Number of borrowers	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
	Gross Amount (₹ crore)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
	Provision held (₹ crore)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Sub standard	Number of borrowers	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
	Gross Amount (₹ crore)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
	Provision held (₹ crore)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Doubtful	Number of borrowers	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
	Gross Amount (₹ crore)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
	Provision held (₹ crore)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
Total	Number of borrowers	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
	Gross Amount (₹ crore)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL
	Provision held (₹ crore)	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL	NIL

Annexure - 4(d)

NIL

(i) In the case of stressed loans transferred or acquired, disclosures should be made.

Details of stressed loans transferred during the year (to be made separately for loans classified as NPA and SMA)

(all amounts in crore)	To ARC's	To permitted transferees	To other transferees (please specify)
No : of accounts			
Aggregate principal outstanding of loans transferred	NIL	NIL	NIL
Weighted average residual tenor of the loans transferred	NIL	NIL	NIL
Net book value of loans transferred (at the time of transfer)	NIL	NIL	NIL
Aggregate consideration	NIL	NIL	NIL
Additional consideration realized in respect of accounts transferred in earlier years	NIL	NIL	NIL

Annexure -4 (e)

a) fraud accounts

	Current Year	Previous Year
Number of frauds reported	NIL	NIL
Amount involved in fraud (₹ crore)	NIL	NIL
Amount of provision made for such frauds (₹ crore)	NIL	NIL
Amount of Unamortised provision debited from 'other reserves' as at the end of the year (₹ crore)	NIL	NIL

Disclosure under Resolution Framework for COVID-19 related stress

Annexure -4 (F)

(Amounts in crore)

Type of borrower	Exposure to accounts classified as Standard consequent to implementation of resolution plan- Position as at the end of the previous half year (A)	Of (A), aggregate debt that Slipped into NPA during the half year	Of (A), amount written off during the half-year	Of (A), amount paid by the borrowers during the half-year	Exposure to accounts classified as Standard consequent to implementation of resolution plan Position as at the end of this half year
Personal Loans	NIL	NIL	NIL	NIL	NIL
Corporate persons*	NIL	NIL	NIL	NIL	NIL
Of which MSMEs	NIL	NIL	NIL	NIL	NIL
Others	NIL	NIL	NIL	NIL	NIL
Total	NIL	NIL	NIL	NIL	NIL

Annexure - 5

5. Exposures

5.a Exposure to Real Estate Sector

Category	Current Year	Previous Year
i) Direct Exposure		
a) Residential Mortgages Lending fully Secured by Mortgages on residential property that is or will be occupied by the borrower or that is rented. Individual housing loans eligible for inclusion in priority sector advances shall be shown separately. Exposure would also include non fund based (NFB) limits.	23.83 0	20.96 0
b) Commercial Real Estate - Lending secured by Mortgages on commercial real estate (office building, retail space, multipurpose commercial premises, multifamily residential buildings, multi tenanted commercial premises, industrial or warehouse space, hotels, land acquisition, development and constructions, etc). Exposure would be also non-fund based (NFB) limits;		0
c) Indirect Exposure Fund based and non-fund based exposures on National Housing Bank and housing Finance Companies.	0	0
Total Exposure to Real Estate Sector	23.83	20.96

Annexure - 5 (B)

b) Exposure to capital market

Particulars	Current Year	Previous Year
i) Direct investment in equity shares, convertible bonds, convertible debentures and units of equity oriented mutual funds the corpus of which is not exclusively invested in corporate debt;	Nil	Nil
ii) Advances against shares / bonds / debentures or other securities or on clean basis to individuals for investment in shares (including IPOs/ ESOPs), convertible bonds, convertible debentures, and units of equity oriented mutual funds;	Nil	Nil
iii) Advances for any other purposes where shares or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds are taken as primary security;	Nil	Nil
iv) Advances for any other purposes to the extent secured by the collateral security of shares or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds i.e. where the primary security other than shares / convertible bonds / convertible debentures / units of equity oriented mutual funds does not fully cover the advances;	Nil	Nil
v) Secured and unsecured advances to stockbrokers and guarantees issued on behalf of stockbrokers and market Makers;	Nil	Nil
vi) Loans sanctioned to corporates against the security of shares / bonds / debentures or other securities or on clean basis for meeting promoter's contribution to the equity of new companies in anticipation of raising resources;	Nil	Nil
vii) Bridge loans to companies against expected equity flows / issues;	Nil	Nil
Viii) Underwriting commitments taken up by the banks in respect of primary issue of shares or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds;	Nil	Nil
ix) Financing to stockbrokers for margin trading ;	Nil	Nil
x) Allexposures to Venture Capital Funds (both registered and unregistered)	Nil	Nil
Total exposure to capital market	Nil	Nil

d) Unsecured advances

(Amounts in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total unsecured advances of the bank	4.89	4.52
Out of the above, amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority etc. have been taken	0	0
Estimated value of such intangible securities	NIL	NIL

Annexure - 6

6. Concentration of deposits advances, exposures and NPAs

a) Concentration of deposits

(Amounts in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total deposits of the twenty largest depositors	35.60	34.50
Percentage of deposits of twenty largest depositors to total deposits of the bank	25.20	24.60

b) Concentration of advances*

(Amounts in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total advances to the twenty largest borrowers	10.82	7.59
Percentage of deposits of twenty largest borrowers to total advances of the bank	15.45	12.59

*Advances shall be computed based on credit exposure i.e. funded and non-funded limits including derivative exposures where applicable. The sanctioned limits or outstanding, whichever are higher, shall be reckoned. However, in the case of fully frawn term loans, where there is no scope for re-drawal of any portion of the sanctioned limit, banks may reckon the outstanding as the credit exposure.

c) Concentration of exposures**

(Amounts in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total exposure to the twenty largest borrowers / customers	NIL	NIL
Percentage of exposures to the twenty largest borrowers / customers to the total exposure of the bank on borrowers / customers	NIL	NIL

** Exposures shall be computed as per applicable RBI regulation.

d) Concentration of NPAs

(Amounts in ₹ crore)

Particulars	Current Year	Previous Year
Total Exposure to the twenty NPA accounts	2.33	3.43
Percentage of exposures to the twenty largest NPA exposure to total Gross NPAs.	59.44%	67.52%

Annexure - 7

10 Transfers to Depositor Education and Awareness Fund (DEA Fund)

(Amounts in ₹ crore)

Sr.No.	Particulars	Current Year	Previous Year
i)	Opening balance of amounts transferred to DEA Fund	0.63	0.62
ii)	Add : Amounts transferred to DEA Fund During the year	0.01	0.01
iii)	Less : Amounts reimbursed by DEA Fund towards claims	0.00	0.00
iv)	Closing balance of amounts transferred to DEA Fund	0.64	0.63

Annexure - 8 (A)

11. Disclosure of complaints.

- a) Summary information on complaints received by the bank from customers and from the Offices of Ombudsman

Sr.No.	Particulars	Current Year	Previous Year
1	Complaints received by the bank from its customers	Nil	Nil
1	Number of complaints pending at beginning of the year	Nil	Nil
2	Number of complaints received during the year	Nil	Nil
3	Number of complaints disposed during the year	Nil	Nil
3.1	Of which, number of complaints rejected by the bank	Nil	Nil
4	Number of complaints pending at the end of the year	Nil	Nil
5	Number of maintainable complaints received by the bank from Office of Ombudsman	Nil	Nil
5.1	Of 5, number of complaints resolved in favour of the bank by Office of Ombudsman	Nil	Nil
5.2	Of 5, number of complaints resolved through conciliation / mediation / advisories issued by Office of Ombudsman	Nil	Nil
5.3	Of 5, number of complaints resolved after passing of Awards by Office of Ombudsman against the bank	Nil	Nil
6	Number of Awards unimplemented within the stipulated time (other than those appealed)	Nil	Nil

Annexure - 8 (B)

8 (b) Top five grounds of complaints received by the bank from customers.

Grounds of complaints,(i.e. complaints relating to)	Number of complaints pending at the beginning of the year	Number of complaints received during the year	% increase/ decrease in the number of complaints received over the previous year	Number of complaints pending at the end of the year	Of 5, number of complaints pending beyond 30 days
Current Year					
Ground - 1	Nil	Nil	Nil	Nil	Nil
Ground - 2	Nil	Nil	Nil	Nil	Nil
Ground - 3	Nil	Nil	Nil	Nil	Nil
Ground - 4	Nil	Nil	Nil	Nil	Nil
Ground - 5	Nil	Nil	Nil	Nil	Nil
Others	Nil	Nil	Nil	Nil	Nil
Previous Year					
Ground - 1	Nil	Nil	Nil	Nil	Nil
Ground - 2	Nil	Nil	Nil	Nil	Nil
Ground - 3	Nil	Nil	Nil	Nil	Nil
Ground - 4	Nil	Nil	Nil	Nil	Nil
Ground - 5	Nil	Nil	Nil	Nil	Nil
Others	Nil	Nil	Nil	Nil	Nil
Total	Nil	Nil	Nil	Nil	Nil

Annexure - 9

Disclosure on Remuneration

Type of disclosure		Information		
Qualitative	(a)	Information relating to the composition and mandate of the Nomination and Remuneration		
	(b)	Information relating to the design and structure os remuneration processes and the		
	(c)	Description of the ways in which current and future risks are taken into account in the		
	(d)	Description of the ways in which the bank seeks to link performance during a		
	(e)	A discussion of the bank's policy on deferral and vesting of variable remuneration and a		
	(f)	Description of the different forms of variable remuneration(i.e.,cash and types of share-linked		
			Current Year	Previous Year
Quantita- tive disclosures (The quantitative disclosures should only cover Whole Time Directors/ Chief Executive Officer/ Material Risk Takers)	(g)	Number of meetings held by the Nomination and remuneration Committee during the financial year and remuneration paid to its members.	nil	nil
	(h)	(i) Number of employees having received a variable remuneration award during the financial year.	nil	nil
		(ii) Number and total amount of sign-on / joining bonus made during the financial year.		
		(iii) Details of severance pay, in addition to accrued benefits, if any.		
	(i)	(i) Total amount of outstanding deferred remuneration, split into cash, shares and share linked instruments and other forms.	nil	nil
		(ii) Total amount of deferred remuneration paid out in the financial year.		
	(i)	Breakdown of amount of remuneration awards for the financial year to show fixed and variable, deferred and non-deferred.	nil	nil
	(k)	(i) Total amount of outstanding deferred remuneration and retained remuneration exposed to ex post explicit and / or implicit adjustments.	nil	nil
		(ii) Total amount of reductions during the financial year due to ex post explicit adjustments.	nil	nil
		(iii) Total amount of reductions during the financial year due to ex post implicit adjustments.	nil	nil
	(l)	Number of MRTs identified.	nil	nil
		(i) Number of cases where malus has been exercised.	nil	nil
		(ii) Number of cases where clawback has been exercised.		
		(iii) Number of cases wher both malus and clawback have been exercised.		
General Quantitative Disclosure		The mean pay for the bank as a whole (excluding sub-staff) and the deviation of the pay of each of its WTDs from the mean pay.	nil	nil

Annexure - 10

Other Disclosures

a) Business Ratios

Particulars	Previous Year	Current Year
i) Interest Income as a percentage to Working Funds ²⁸	7.48	7.46
ii) Non-interest income as a percentage to Working Funds ²⁸	0.34	0.08
iii) Cost of Deposits	8.24	6.39
iv) Net Interest Margin ²⁹	0.06	3.39
v) Operating Profit as a percentage to Working Funds ²⁸	1.34	0.99
vi) Return on Assets ³⁰	7.82	7.98
vii) Business (deposits plus advances) per employee ³¹ (in ₹ crore)	11.80	14.09
viii) Profit per employee (in ₹ crore)	0.14	0.13

B) Bancassurance Business

The details of fees/brokerage earned in respect of insurance broking,	Current Year	Previous Year
	NIL	NIL

c) Marketing and distribution --- NIL

d) Disclosures regarding Priority Sector Lending Certificates (PSLCs)-- NIL

The amount of PSLCs (category-wise) sold and purchased during the year shall be disclosed '-Nil

e) Provisions and contingencies

Provision debited to Profit and Loss Account	Current Year	Previous Year
i) Provisions for NPA	0.00	0.00
ii) Provision towards NPA	4.53	0.75
iii) Provision for IDR.	0.00	0.00
iv) Other Provisions and Contingencies (with details)	0.50	0.10

g) Payment of DICGC Insurance Premium

Sr.No.	Praticulars	Current Year	Previous Year
i)	Payment of DICGC Insurance Premium	0.18	0.21
ii)	Arrears in payment of DICGC premium	0.00	0.00

Annexure - 11

Disclosure of facilities granted to directors and their relatives

Bank shall disclose any fund or non-fund (guarantees, letters of credit, etc.) facilities extended to directors, their relatives, companies or

No.	Name of the Director	Name of Relative / Company / Firm	Limit sanctioned (FDOD)	Outstanding
1	RAJNIKANT V GANDHI	M/S V R AND SONS	0.80	0.76
2	RAJNIKANT V. GANDHI	R. V. GANDHI	0.02	0.02
3	MAMTABEN S. SHAH	V.P.SHAH	0.04	0.04
4	ISHITA M. DOSHI	M. H. GANDHI	0.09	0.06
5	ISHITA M. DOSHI	J. R. DOSHI	0.02	0.02
6	ISHITA M. DOSHI	M. R. DOSHI	0.03	0.02
7	ISHITA M. DOSHI	R. D. DOSHI	0.04	0.05
8	ISHITA M. DOSHI	M. H. GANDHI	0.05	0.06
9	H.J.DSHI	M.J. DOSHI	0.01	0.01
10	H.J.DSHI	Y.G.GANDHI	0.01	0.01
	TOTAL		1.11	1.05

સાઈબર અવેરનેસ અને સલામતી

- (૧) **OTP આપવો નહીં** : ઓનલાઈન ખરીદી કરતી વખતે કે પેમેન્ટ કરતી વખતે અને હવે તો ATM માંથી નાણા ઉપાડતી વખતે પણ આપને OTP ની જરૂર પડે છે. પરંતુ તમારા મોબાઈલમાં આવેલ OTP નંબર મેળવવા માટે આજકાલ છેતરપીંડી કરવાવાળા માણસો, “હું બેંકમાંથી બોલું છું” અથવા “હું ડેબીટ કાર્ડ વિભાગમાંથી બોલું છું.” “સાઈબર કાઈમમાંથી બોલું છું” વિગેરે કીમીયાઓ અપનાવી તમારી પાસેથી ચેનકેન પ્રકારે OTP નંબર મેળવવા પ્રયત્ન કરે છે. ઉપરાંત આવી વ્યક્તિઓના મોબાઈલનાં True Caller માં પણ જે તે વિભાગનાં નામ લખેલ હોય, આપ OTP નંબર આપવાની ભૂલ કરી બેસો છો માટે આ રીતે વિશ્વાસમાં આવી OTP નંબર કોઈને આપવો નહીં.
- (૨) **આપનો PIN, CVV તેમજ પાસવર્ડ** : OTP ની જેમ જ આપના કાર્ડના પાછળ ભાગ પર છાપેલ CVV તેમજ કાર્ડ ઉપયોગ માટે આપે નક્કી કરેલ OTP તેમજ પાસવર્ડ OTP તો કરતાં પણ વધુ અગત્યતા ધરાવે છે જે અંગે નીચેનાં મુદ્દાઓ રાખશો તો સાઈબર ફ્રોડથી આપ બચી શકો છો આપનાં મોબાઈલ ફોનમાં કાર્ડના આગળ-પાછળનો ફોટો પાડીને સેવ રાખવો નહીં.
- (૩) **ઓનલાઈન ખરીદી** : ઓનલાઈન ચીજવસ્તુ મંગાવતી વખતે કેશબેંક, ઓર્ડર, કેન્સલ રીફંડ મેળવવા માટે હાલમાં લોકો ગુગલ ઉપર સર્ચ કરી હેલ્પલાઈન નંબર અથવા કસ્ટમર કેર નંબર શોધતા હોય છે અને ફ્રોડલોકો દ્વારા પ્રતિષ્ઠિત કંપનીના હેલ્પલાઈન નંબરમાં પોતાના નંબર નાંખી તમને મદદ કરવા માટે લીન્ક મોકલાવી અથવા ગ્રીફ્ટ વાઉચરના મેસેજ મોકલી તેઓ તરફથી Quick Support Any Desk નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી મોબાઈલ ફોન રીમોટ કરી ઓનલાઈન નાણાંકીય વ્યવહારની બધી વિગતો જાણી લોકોના એકાઉન્ટમાંથી નાણાંની છેતરપીંડી કરતા હોય છે. આવી તમામ લીન્કોથી સાવધાન રહેવું જોઈએ અને કોઈ અજાણ્યા વ્યક્તિઓ ફોનમાં કોઈ પ્રોસેસ કરાવે તે નહીં કરવા અને મોબાઈલમાં આવતો કોઈપણ પ્રકારનો ઓટીપી કોઈને આપવો નહીં.
- (૪) **ATM/ ડેબીટ કાર્ડ ક્લોનીંગ** : છેતરપીંડી કરનાર, એટીએમ મશીનમાં Card Slot માં Scimmer ફીટ કરે છે. જેથી કેશ ઉપાડતી વખતે એટીએમમાં કાર્ડ દાખલ કરતાં જ Scimmer મશીન આપનાં કાર્ડની મેગ્નેટીક સ્ટ્રીપને વાંચીને તમારા કાર્ડનાં તમામ ડેટા એકત્ર કરે છે, ત્યારબાદ આ એકત્ર કરેલ ડેટાને નવા કોરા કાર્ડ પર Rewrite કરે છે આ રીતે ક્લોન કરેલ કાર્ડનો ઉપયોગ કરી અન્ય એટીએમમાંથી નાણાંનો ઉપાડ કરી લે છે આ પ્રકારની છેતરપીંડીથી બચવું હોય તો
- તમારો PIN અવારનવાર બદલતા રહો.
 - ATM માંથી નાણાં ઉપાડતી વખતે ATM મશીનમાં કોઈ વધારાનું ડીવાઈસ લાગેલ નથી તે ચેક કરશો.

: ઓડીટર્સ રીપોર્ટ :

પ્રતિ,
સભાસદ શ્રી,
ધી લુણાવાડા પીપલ્સ કો. ઓપરેટીવ બેન્ક લિ.,
લુણાવાડા.

૧. આપની બેંકના હિસાબી વર્ષ ૨૦૨૪-૨૦૨૫ ના સ્ટેચ્યુટરી ઓડીટર તરીકે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદના પત્ર ક્રમાંક AMD.DOS.MAG.ACG & LEGAL No. S-904/02-16-028/2024-25 DT.23-08-24 થી અમારી નિમણૂંક કરવામાં આવેલ છે. શરતોને આધીન અમારી ઓડીટ કામગીરી બેંક દ્વારા વખતો વખત પુરી પાડવામાં આવેલ સહકારી બેન્કોના ઓડીટની મોખિક તેમજ દસ્તાવેજી માહિતીના આધારે પુર્ણ કરેલ છે. આ સંસ્થાનું પાકું સરવૈયુ, નફા-નુકશાન પત્રક તથા હિસાબી દફતરની ચકાસણી કરી અમો અમારા આ સાથે જોડેલ હિસાબના અનુસંધાનની નોંધ (Notes on Accounts) માં દર્શાવેલ હિસાબી નીતિઓ, સિધ્ધાંતો, હિસાબી નોંધો તથા અન્યેષણ નોંધના કલમ - ૮૪ હેઠળના પત્રકો તેમજ અન્ય સંલગ્ન પત્રકો / સામાન્ય શેરો તેમજ ઓડીટ મેમો ભાગ-૧ તથા ભાગ-૨ ને આધિન અમો નીચે મુજબ અહેવાલ રજૂ કરીએ છીએ.

- હિસાબી પત્રકો તૈયાર કરવાની જવાબદારી સંસ્થાના વ્યવસ્થાપક મંડળની છે.
૨. ભારતીય બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ અંતર્ગત આ નાણાંકીય પત્રકો, સંસ્થાની સાચી અને વ્યાજબી નાણાંકીય સ્થિતિ, નાણાંકીય કામગીરી અને રોકડ પ્રવાહ રજૂ કરે છે તે રીતે તૈયાર કરવાની જવાબદારી સંસ્થાના વ્યવસ્થાપક મંડળની છે. આ જવાબદારીઓમાં, સંસ્થામાં આંતરિક અંકુશનો પ્રકાર અને તેની વ્યવસ્થા નક્કી કરવાની, તેનો અમલ અને તેની જાળવણી અને તેને આધિન તૈયાર કરવામાં આવેલા નાણાંકીય પત્રકો છેતરપિંડી કે ભૂલના કારણે મહત્વના ખોટા વિધાનો તેમજ ખોટી રજૂઆતોથી મુક્ત છે તેનો સમાવેશ થાય છે.

ઓડીટર્સ જવાબદારી

૩. અમારી જવાબદારી અમારા ઓડીટના આધારે આ નાણાંકીય પત્રકો અંગે અભિપ્રાય આપવાની છે. ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા વખતો વખત જારી કરાયેલા ઓડીટના સામાન્ય રીતે સ્વીકારાયેલ ધોરણો પ્રમાણે અમોએ ઓડીટ કામગીરી બજાવવાની રહે છે. આ ધોરણોની જરૂરિયાત પ્રમાણે અમારે ઓડીટનું આયોજન અને કાર્ય એવી રીતે કરવાનું રહે છે કે જેથી કરીને નાણાંકીય પત્રકો કોઈપણ જાતના મહત્વના ખોટા વિધાનો તેમજ ખોટી રજૂઆતોથી મુક્ત છે કે કેમ તે અંગેની જરૂરી ખાત્રી અમોને મળી છે.
૪. અન્યેષણની કામગીરીમાં, નાણાંકીય પત્રકોમાં દર્શાવવામાં આવેલ રકમો ખુલાસાઓના ઓડીટ પુરાવા મેળવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાની પસંદગીનો આધાર, નાણાંકીય પત્રકો છેતરપિંડી કે ભૂલના કારણે મહત્વના ખોટા વિધાનો તેમજ ખોટી રજૂઆતો હોવા અંગેના

જોખમ અંગે ઓડીટર્સના પોતાના અંગત મૂલ્યાંકન અને નિર્ણયો ઉપર રહેલો છે. આવા જોખમોનું મૂલ્યાંકન કરવા માટે ઓડીટર્સ સંસ્થાની આંતરિક અંકુશ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તેમજ બેન્ક દ્વારા તૈયાર કરવામાં તેમજ રજૂ કરવામાં આવેલા નાણાંકીય પત્રકોને આધારિત સંજોગોને આધિન યોગ્ય ઓડીટ પ્રક્રિયા નક્કી કરવાની હોય છે. અન્યેષણની કામગીરીમાં, સંચાલકો દ્વારા ઉપયોગમાં લેવાયેલ નામાના સિધ્ધાંતો તથા કરવામાં આવેલા અગત્યના અંદાજોના વ્યાજબીપણાની ચકાસણી કરવામાં આવે છે. ઉપરાંત નાણાંકીય પત્રકોની સમગ્રતથા રજૂઆતની યોગ્ય આકારણી તેમજ મૂલ્યાંકનનો સમાવેશ થાય છે.

૫. અમો માનીએ છીએ કે અમો દ્વારા મેળવાયેલા ઓડીટ પુરાવા અમોને નીચે મુજબ ઓડીટ અભિપ્રાય આપવા માટે પુરતો અને વ્યાજબી આધાર પુરો પાડે છે.

ઓડીટર અભિપ્રાય

૬. અમારી માન્યતા મુજબ અને અમોને આપવામાં આવેલી માહિતીઓ અને ખુલાસાઓ મુજબ, તેમજ આ સાથે જોડેલ હિસાબના અનુસંધાનની નોંધ (Notes on Accounts) માં આપવામાં આવેલી હિસાબો સંબંધી મહત્વની નીતિઓ, નોંધો, વિગતો તેમજ અન્યેષણ નોંધના સામાન્ય શેરાના ભાગ-૧ તથા ભાગ-૨ ને આધિન બેન્કના હિસાબો બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ અંતર્ગત જરૂરી એવી માહિતીઓ પુરી પાડે છે અને ભારતમાં પ્રવર્તમાન અને હિસાબોમાં સામાન્ય રીતે સ્વીકારાયેલ ધોરણો પ્રમાણે સુસંગત રહીને આ નાણાંકીય પત્રકો હિસાબોની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ રજૂ કરે છે.

(૧) જેમ કે પાકા સરવૈયાની બાબતમાં તા. ૩૧/૩/૨૦૨૫ ના રોજની બેન્કની નાણાંકીય સ્થિતિ.

(૨) જેમ કે નફા-નુકશાન પત્રક બાબતમાં તે જ તારીખના રોજ પુરા થતા વર્ષનો બેન્કનો નફો.

અન્ય કાયદાકીય અને નિયંત્રક બાબતો અંગે અહેવાલ

પાકુ સરવૈયું તથા નફા-નુકશાન ખાતુ બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના પરિશિષ્ટ ૩ માં આપવામાં આવેલ અનુક્રમે ફોર્મ પએથ તેમજ પબીથ મુજબ તૈયાર કરવામાં આવેલ છે.

અમો વધુમાં જણાવીએ છીએ, કે

- (૧) અમારી ઉત્તમ જાણ અને માન્યતા મુજબ અમારા ઓડીટ માટે જરૂરી એવી સઘળી માહિતીઓ અને ખુલાસાઓ અમારા સંતોષ મુજબ અમોને પુરા પાડવામાં આવેલા છે.
- (૨) બેન્ક ને કોઈ શાખા નથી.
- (૩) આ અહેવાલ સાથે રજૂ કરાયેલ સરવૈયું તથા નફા-નુકશાન ખાતુ, બેન્કના હિસાબી ચોપડાઓ તથા પત્રકો સાથે સુસંગત છે.
- (૪) બેન્કની વ્યવસ્થાપક સમિતિ દ્વારા બેન્કનો વહીવટ સહકારી કાયદા કાનૂનની જોગવાઈ અને પેટા નિયમોને આધિન રહીને ચલાવવામાં આવે છે અને કાયદા-કાનૂનની જોગવાઈઓનું સમિતિ દ્વારા મહદઅંશે પાલન થાય છે.

- (૫) બેન્કની વ્યવસ્થાપક સમિતિ દ્વારા આર.બી.આઇ. ના વખતો વખતના સરક્યુલર્સ/ઠરાવો અને માર્ગદર્શક સુચનાઓ વિગેરેનું મહદઅંશે પાલન કરવામાં આવે છે. (જુઓ સામાન્ય શેરો)
- (૬) બેન્કમાં હિસાબી દફતર, વાર્ષિક હિસાબો/હિસાબી પદ્ધતિ આર.બી.આઇ. ની સુચના તેમજ સહકારી કાયદાની જોગવાઈઓ અનુસાર નિભાવવામાં આવે છે.
- (૭) ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા ઘોષિત કરાયેલા અને બેન્કને લાગુ પડતા જરૂરી એવા એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડસનું મહદ્ અંશે પાલન થયેલ છે. આ નોંધને આધિન સરવૈયું તા. ૩૧/૩/૨૦૨૫ ના રોજની બેન્કની આર્થિક સ્થિતિનું વાસ્તવિક ચિત્ર દર્શાવે છે તેમજ સરવૈયામાં દર્શાવેલ મૂડી-દેવા અને મિલ્કત-લેણા તેમજ નફા-નુકશાનની પરિસ્થિતિ વાસ્તવિક અને ખરી છે.
- (૮) બેન્ક દ્વારા એસ.એલ.આર અને સી.આર. આર.ના નિયત ધોરણ જળવાયેલ છે.
- (૯) બેન્ક દ્વારા આર.બી.આઇ.ની એન.પી. એ. અંગેની ગાઈડ લાઈન મુજબ મિલ્કતોનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. અને તે અંગે પર્ચાસ જોગવાઈ કરવામાં આવેલ છે. (જુઓ સામાન્ય શેરો)
- (૧૦) અમોને મળેલ માહિતી પ્રમાણે બેન્કના વ્યવસ્થાપક મંડળના સભ્યોને તેમજ તેવા સભ્યોની હિત ધરાવતી તેમજ તેમના કુટુંબીજનની હિત ધરાવતી સંસ્થાઓને /પેઢીઓને ઓડીટ સમય દરમિયાન બેંકની ફીક્સ ડીપોઝીટ સામે ઓવરડ્રાફ્ટ ધીરાણ આપવા સિવાય બેન્ક દ્વારા અન્ય કોઈ ધિરાણ કરવામાં આવ્યું નથી.
- (૧૧) અમોને આપેલ માહિતી પ્રમાણે બેન્કના હોદ્દેદારો કે ડિરેક્ટરશ્રીઓ, દ્વારા સહકારી કાયદા કાનૂન કે પેટા નિયમોની જોગવાઈ મુજબની ગેરલાયકાત વ્હોરેલ નથી.
- (૧૨) બેન્કના કાર્યવાહકો દ્વારા વનટાઈમ સેટલમેન્ટ યોજના કે ડીપોઝીટ સેટ ઓફ યોજના વર્ષ દરમિયાન દાખલ કરવામાં આવી નથી. જેથી આ અંગેના કોઈ કિસ્સા જોવા મળેલ નથી.
- (૧૩) બેંક દ્વારા હિસાબી વર્ષ દરમિયાન લેણા માંડવાળ કરવાના કિસ્સાઓ નોંધાયેલ નથી.
- (૧૪) બેંક દ્વારા કોર્ટ રાહે સમાધાન-માંડવાળના કિસ્સાઓ વર્ષ દરમિયાન નોંધાયેલ નથી.

તારીખ : ૧૫/૦૫/૨૦૨૫

સ્થળ : લુણાવાડા

M/S. JOSHI PATELBHATT & CO. (C.A)

FRN NO. 135582W

PAN NO. GUJ. CO. OP. PANEL NO.

100.VAD/FIRM/154

RBI UCN NO. 953537

તા.૩૧-૩-૨૦૨૪ ના રોજ રોકાણોની વિગત

પરિશિષ્ટ -અ

અ.નં.	વિગત	રકમ રૂ.	પૈસા
(૧)	ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્ક (TD)	૧૫૦૦૦૦૦૦	૦૦
(૨)	ગવર્નમેન્ટ સીક્યોરીટી	૫૧૬૨૪૮૫૦૦	૦૦
(૩)	ગવર્નમેન્ટ સ્ટેટ લોન બોન્ડ	૨૫૦૪૩૦૧૮૨	૦૦
(૪)	ટ્રેઝરીબીલ RBI	૯૬૨૭૯૫૦	૦૦
(૫)	ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પો.બોન્ડ	૭૫૦૦૦૦૦	૦૦
(૬)	Axis Bank (Term Depo. A/c)		
(૭)	The P.D.C. Bank Ltd. (SHARES)	૫૦૦	૦૦
(૮)	The P.D.C Bank-Lunawada-FDR A/c	૨૫૬૮૦૧૨૭	૦૦
(૯)	યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા FD A/c	૧૦૦૦૦૦૦૦	૦૦
(૧૦)	Au small finance Bank (TDR)	૨૫૦૦૦૦૦૦	૦૦
(૧૧)	The G.S.C. Bank Ltd. SHARES	૧૦૦૦૦	૦૦
(૧૨)	HDFC Bank LTD. T.D. A/C.	૧૫૦૦૦૦૦૦	૦૦
(૧૩)	IDBI BK FD A/c	૫૦૦૦૦૦૦	૦૦
(૧૪)	SBI FDR A/c	૫૦૦૦૦૦૦	૦૦
(૧૫)	IDFC First bank ltd. Term Depo. a/c		
(૧૬)	Bank of baroda FD A/c	૨૦૭૭૫૬૪૧	૦૦
	કુલ સરવાળો	૯૦૫૨૭૨૯૦૦	૦૦

બેંક ની પ્રગતિના સોપાનો

સને ૨૦૨૩-૨૦૨૪ ના તા. ૩૧/૦૩/૨૦૨૫ ના વર્ષાન્તે સાતમી વખત બેંકનો ચોખ્ખો નફો (૧ કરોડથી વધુ) રૂ. ૧૮૮૫૬૫૫૨-૦૦ આવેલ છે. જે બેંકની ઉત્તરોત્તર પ્રગતિ સુચવે છે.

ડીવીડન્ડ

સને ૨૦૨૧-૨૨ ના વર્ષનું ડીવીડન્ડ જે સભાસદો લઈ ગયેલ ન હોય તેઓએ તા.૩૧-૧૦-૨૫ સુધીમાં બેન્કમાં આવી મેળવી લેવું. માનવંતા સભાસદશ્રીઓને સહર્ષ જણાવાનું કે આપના ડીવીડન્ડની રકમ ત્વરીત આપના બચત ખાતામાં ઓટો જમા કરવાની વ્યવસ્થા કરેલ હોઈ આપના બચત ખાતાનો નંબર બેંકમાં તા.૩૦-૯-૨૦૨૫ સુધીમાં આપી જશો જેથી આપના ડીવીડન્ડની રકમ સીધી જ આપના ખાતામાં જમા કરી શકાય.

શ્રદ્ધાંજલિ

વર્ષ દરમિયાન ગુજરી ગયેલ બેંકના નામી-અનામી સભાસદો, થાપણદારોને પરમ કૃપાળુ પરમાત્મા તેઓના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

સભાસદ કલ્યાણનિધિ યોજના વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નો હિસાબ

આવક		જાવક	
ક્ર. પૈસા		ક્ર. પૈસા	
૪૨૬૬૬૫૪-૦૦	તા.૩૧-૩-૨૦૨૪નું બેલેન્સ	૩૬૮૦૦૦-૦૦	ગુજરી ગયેલ સભાસદોના વારસદારોને ચુકવ્યા.
૨૬૪૭૫૦-૦૦	નવી સભ્ય ફી (૧૨૫૦ X ૧૭૭) ૨૨૧૨૫૦ (૭૫૦ X ૫૮) ૪૩૫૦૦		(૨૫૦૦૦ X ૫) ૧૨૫૦૦૦ (૨૭૦૦૦ X ૧૩) ૨૪૩૦૦૦
	૨૬૪૭૫૦		૩૬૮૦૦૦
૪૦૦-૦૦	ડુપ્લીકેટ સર્ટીફિકેટ ફી (સભ્ય ૧૦૦ X ૪ રૂ.) ૪૦૦	૫૭૫૦-૦૦	ડબલ વખત સભાસદ થવાથી પરત (૧૨૫૦ X ૪) ૫૦૦૦ (૧૨૫૦ X ૧) ૭૫૦
૨૪૨૦૮૭૨-૦૦	બેંકે ઉમેરેલ રકમ		૫૭૫૦
		૬૫૭૮૦૨૬-૦૦	બાકી રકમ
૬૮૫૨૭૭૬-૦૦	કુલ	૬૮૫૨૭૭૬-૦૦	કુલ

સભાસદ કલ્યાણનિધિ યોજનાની સમિતિ

શ્રી રજનીકાન્ત વી. ગાંધી ચેરમેનશ્રી

સભ્યશ્રીઓ

ડૉ. પ્રકાશભાઈ કે. દોશી

સભ્યશ્રી

શ્રી વિરેશભાઈ બાબુલાલ રાવલ

સભ્યશ્રી

સભ્યશ્રીઓ

શ્રી રણવીરસિંહ નાથુસિંહ રાઠોડ

સભ્યશ્રી

શ્રી કીર્તિકુમાર નર્મદાશંકર પંડ્યા

સભ્યશ્રી

Re-KYC અંગેની સૂચના

બેંકના તમામ ખાતેદારોનું ધ્યાન દોરવામાં આવે છે, KYC અંગે જે તે સમયે આપેલ માન્ય પુરાવાઓ જેમાં લો રીસ્ક કેટેગરી માટે ૧૦ વર્ષ, મીડીયમ રીસ્ક કેટેગરી માટે - ૮ વર્ષ અને હાઈ રીસ્ક કેટેગરી માટે ૨ - વર્ષ ઉપરાંતનો સમય પસાર થઈ ગયેલ હોય તેવા ખાતેદારોએ બેંકના એકાઉન્ટ વિભાગમાં Re-KYC નું ફોર્મ ભરી KYC ના માન્ય પુરાવા સાથે જમા કરાવી પોતાનું ખાતું નિયમિત કરાવી લેવું, નહિ તો રીઝર્વ બેંકના નિયમ મુજબ ખાતામાં લેવડ-દેવડ કરવામાં આવશે નહીં.

નિષ્ક્રીય ખાતેદારો જોગ

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશ મુજબ છેલ્લા ૧૦ વર્ષથી જે ખાતેદારના ખાતામાં કોઈપણ લેવડ-દેવડ થયેલ ન હોય તેવા નિષ્ક્રીય ખાતાની જમા રકમ રીઝર્વ બેંકને મોકલી દેવાની હોય છે. માટે જે ખાતેદાર આવા બેંક ખાતા ધરાવતા હોય તેમને તેમના KYC બેંકમાં આપી જરૂરી લેવડ-દેવડ કરી ખાતું સક્રિય કરી દેવું નહીતર આવા ૧૦ વર્ષથી નિષ્ક્રીય ખાતાને Un-Claim ગણી જમા રકમ રીઝર્વ બેંકમાં જમા કરી દેવામાં આવશે તેની દરેક ખાતેદારે નોંધ લેવી.

સભાસદો/થાપણદારો માટે TDS (કર કપાત) અંગે જાણકારી

૨૦૧૫-૨૦૧૬ ના વર્ષ માટે બજેટમાં રજુ થયેલ દરખાસ્ત મુજબ સહકારી બેંકોના ડીપોઝીટ પરના વ્યાજના ટીડીએસમાંથી મુક્તિ હતી જે તા. ૦૧-૦૬-૨૦૧૫ થી રદ કરવામાં આવેલ છે. તેથી હવે સહકારી બેંકના સભાસદ તેમજ નોમીનલ સભાસદની ડીપોઝીટના વ્યાજમાંથી પણ કરકપાત (ટીડીએસ) કરવામાં આવશે જેની તમામ થાપણદારોએ નોંધ લેવી.

બેંક ટી.ડી.એસ. ક્યારે કાપશે?

જો થાપણદારનું તમામ ટર્મ ડીપોઝીટનું કુલ વાર્ષિક વ્યાજ જે તે નાણાકીય વર્ષમાં રૂ. ૫૦,૦૦૦/- થી (સિનિયર સીટીઝન માટે રૂ. ૧,૦૦,૦૦૦/-) વધારે થાય તો પાનકાર્ડ ધરાવનારનો ૧૦ ટકા અને પાનકાર્ડ ન ધરાવનારનો ૨૦ ટકાના દરે ટી.ડી.એસ. કપાશે.

જો થાપણદારની કુલ આવક ઇન્કમેટેક્સ કાયદાના નીતિ-નિયમોનુસાર કરપાત્ર થતી ન હોય તેવા થાપણદારોએ ઇન્કમેટેક્સના નીતિનીયમોને આધિન ફોર્મ નં. ૧૫-એચ અથવા ફોર્મ નં. ૧૫ જી રજુ થયેથી તેઓના વ્યાજ આવકમાંથી ટી.ડી.એસ. કપાત કરવામાં નહિ આવે પરંતુ આવા કિસ્સામાં પાનકાર્ડ હોવું ફરજિયાત છે.

૧૫-જી અને ફોર્મ નં. ૧૫ એચ અંગે જાણકારી:

૧	ફોર્મ ૧૫ જી કોણ આપી શકે?	વ્યક્તિ, એચ.યુ.એફ., એસોસીએશન ઓફ પર્સન બોડી ઓફ ઇન્ડીવીડ્યુઅલ્સ અને જેની કુલ આવક રૂ. ૨,૫૦,૦૦૦/- થી ઓછી હોય તે.
૨	ફોર્મ ૧૫ એચ કોણ આપી શકે?	સીનિયર સીટીઝન વ્યક્તિ (આવક વેરાના કાયદા પ્રમાણે જે વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોય તેવી વ્યક્તિ અને જેની કુલ આવક રૂ. ૩,૦૦,૦૦૦/- થી ઓછી હોય તે.)
૩	ફોર્મ ૧૫ જી કે ૧૫ એચ ક્યારે આપવાનું થાય?	જ્યારે વ્યાજની રકમ રૂ. ૫૦,૦૦૦/- (સીનિયર સીટીઝન માટે રૂ. ૧,૦૦,૦૦૦/-) કે તેથી વધુ થઈ જાય અને કરકપાત કરવાની થાય તે દરેક નાણાકીય વર્ષના એપ્રિલ માસમાં.

નોંધ :-

- (૧) બેંક સાથેના પત્રવ્યવહારની અનુકુળતા માટે જે સભાસદ ખાતેદારોના સરનામાં ફેરફાર થયેલ / થવાનો હોય તેમણે બેંકને તુરંત જ લેખિત જાણ કરવી.
- (૨) જે સભાસદો ડિવિડન્ડ વોરંટની રકમ લઈ ન ગયા હોય તેમણે તે રકમ લઈ જવી. ત્રણ વર્ષ અગાઉના ડિવિડન્ડની રકમ પેટાનિયમ મુજબ રીઝર્વ ફંડ ખાતે જમા લેવામાં આવતી હોઈ આપનાં બચત ખાતા બેંકમાં સત્વરે ખોલાવી લઈ ડિવિડન્ડની રકમ આપના ખાતામાં દર વર્ષે ડાયરેક્ટ જમા કરી શકાય જેથી આપને ડિવિડન્ડની ખોટ જાય નહીં.
- (૩) શેર સર્ટિફિકેટ તૈયાર થઈ ગયેલ છે જેમને ન મળ્યા હોય તેમણે બેંકમાંથી મેળવી લેવા વિનંતી છે.
- (૪) દરેક સભાસદો / ખાતેદારોએ પોતાનાં વારસદારોની નિમણૂંક નિયમ મુજબ બેંક સાથેના વ્યવહારને લાગે વળગે છે ત્યાં સુધી પોતે જ કરવાની હોય છે જેથી વારસદારના નામ નોંધાયેલ ન હોય તો અવશ્ય નોંધાવી લેશો જેથી ભવિષ્યમાં કોઈ જાતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
- (૫) રૂ. ૫,૦૦,૦૦૦/- સુધીની થાપણો થાપણ વીમા યોજના હેઠળ સુરક્ષિત છે.
- (૬) જે સગીર ખાતેદારો પુખ્ત વયના થયા છે તેઓએ જરૂરી KYC પુરાવા સાથે બેંકની મુલાકાત લઈ પોતાના ખાતામાં માઈનોર ટ્રુ મેજરની પ્રોસેસ કરાવી લેવી. અન્યથા આવા ખાતાઓના વ્યવહાર સ્થગિત કરવામાં આવશે.
- (૭) રીઝર્વ બેંકની નવી ગાઈડલાઈન + સપ્લીમેન્ટ ફોર્મ તથા નિયમાનુસાર તારીખ ૩૦-૦૯-૨૦૨૫ સુધીમાં લોકર ના નવા ફોર્મ ભરી જવા ત્યારબાદ નવા ફોર્મ + સપ્લીમેન્ટ ફોર્મ ન ભરનારને લોકર ઓપરેટ કરવા દેવામાં નહીં આવે જરૂરી ડોક્યુમેન્ટમાં દરેક વ્યક્તિના પાનકાર્ડ ની નકલ-૧ (સેલ્ફ એટેસ્ટેડ) આધાર કાર્ડની નકલ-૧ (સેલ્ફ એટેસ્ટેડ) તથા પાસપોર્ટ સાઈઝનો ફોટો ૧ (દરેક) નો લાવવો ફરજિયાત છે.
- (૮) જે સભાસદ ગુજરી ગયા હોય તેમના વારસે તાત્કાલિક શેર ટ્રાન્સફર કરાવી જવા.

MANAGER / CEO

ધી લુણાવાડા પીપલ્સ કો.ઓ.લેન્ડ લી.

**બેંકના પેટા નિયમમાં સુધારા-વધારા અંગેનું
પરિશિષ્ટ - “અ”**

પેટા નિયમ નંબર (૧)	હાલનો પેટા નિયમ (૨)	સુધારા કર્યા બાદ બનતો પેટા નિયમ (૩)	સુધારાનું કારણ (૪)
૫૬ (બ) (૪)	વસુલ થયેલા શેર ભંડોળના ૨ ટકા થી વધુ નહીં તેટલી રકમ તે વર્ષમાં ડિવિડન્ડ ઈક્વીલાઈઝેસન્સ ફંડ ખાતે જમા કરવામાં આવશે. ચાલુ ફંડ વસુલ થયેલા શેર ભંડોળના $1\frac{1}{4}$ ટકા સુધી ભેગું કરવામાં આવશે. ડિવિડન્ડ આપવા જીલ્લા રજીસ્ટારશ્રીની પ્રથમ મંજૂરી વિના આ ફંડ માટે કોઈપણ રકમ ઉપાડવા દેવામાં આવશે નહીં.	૨૬ કરવામાં આવેલ છે.	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરકયુલર નંબર D.O.R. CAP. REC. No. 30/09 18.201/2024-25 તા. 30-09-2024 ના પરિપત્ર ને અનુરૂપ થવા.
૪૪	લોન્સ અને એડવાન્સીઝ (ધિરાણો) લુણાવાડા તથા ખાનપુર તાલુકા પુરતું છે. બીજુ વખતો વખત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વખતો વખત અપાયેલા આદેશોને તે આધીન રહેશે.	લોન્સ અને એડવાન્સીઝ (ધિરાણો) પૈકી હાથર-પરચેઝ તથા સોના-ચાંદીના દાગીના સામે લોન મહીસાગર જીલ્લો કરવા માટે મંજૂર કરવામાં આવે છે તથા વખતો વખત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વખતો વખત અપાયેલા આદેશોને તે આધીન રહેશે.	CD Ratio જોતા ધિરાણ વધારવાના હેતુસર

BANKERS

ધી પંચમહાલ ડિસ્ટ.કો.ઓપ.બેંક લી. (લુણાવાડા)
ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લી. અમદાવાદ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લુણાવાડા
બેંક ઓફ બરોડા, લુણાવાડા
Union Bank of India

HDFC BANK LTD.VADODARA
AXIS BANK LTD,GODHRA
IDBI BANK LTD, LUNAWADA
AU SMALL FINANCE BANK LTD, LUNAWADA
IDFC FIRST BANK LTD.
UJJIVAN SMALL FINANCE BANK

ધી લુણાવાડા પીપલ્સ કો.ઓ. બેન્ક લીમીટેડ, લુણાવાડા

સભાસદશ્રીઓ જોગ-પ્રોત્સાહન ઇનામ

આથી આપણી બેન્કના સભાસદશ્રીઓને જણાવવાનું કે આપણી બેન્ક તરફથી સને ૨૦૨૪-૨૦૨૫ના વર્ષની પરીક્ષાઓમાં ધારા ધોરણોમાં પ્રથમ પ્રયત્ને ઉત્તીર્ણ થયેલ આપના બાળકની માર્ક્સશીટ ટુ કોપી તથા સર્ટીફિકેટની નકલ તા. ૩૧-૧૦-૨૦૨૫ સુધીમાં અને જે ધોરણોના પરિણામ બાકી છે તેઓના બહાર પડ્યેથી ૧૦ દિવસમાં બેન્કના CEOશ્રીને પહોંચાડવા જાણ કરવામાં આવે છે. જેથી નક્કી કરેલ નિયમ મુજબ ઇનામ ફાળવી શકાય.

બેન્કના કામકાજનો સમય સોમવાર થી શનિવાર સવારના ૧૦-૩૦ થી બપોરના ૩-૩૦ સુધી

લોકર્સ માટેનો સમય સોમવાર થી શનિવાર સવારના ૧૦-૩૦ થી બપોરના ૪-૦૦ સુધી

ક્લીયરીંગ માટેનો સમય સોમવાર થી શનિવાર સવારના ૧૦-૦૦ થી બપોરના ૪-૦૦ સુધી
ઉપરોક્ત સમય દરમિયાન આવેલ ચેકો તે દિવસે ક્લીયરીંગમાં જશે. ત્યારબાદ આવેલ ચેકો બીજા દિવસે ક્લીયરીંગમાં જશે. જેની નોંધ લેવી

(બીજો અને ચોથો શનિવાર રજા રહેશે.)

લોકર્સના ભાડુઆતો જોગ

આથી આપણી બેન્કના લોકર્સ ધરાવતા ખાતેદારોને જણાવવાનું કે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સૂચના મુજબ દરેક લોકર્સની ચાવીઓને બેન્કનો કોડ ફરજિયાત એમ્બોઝ કરવાનો હોવાથી દરેક પોતાના લોકર્સની ચાવી ઉપર બેન્કના કોડ એમ્બોઝ કરાવી જવા જાણ કરવામાં આવે છે. તથા KYC દસ્તાવેજો ન આપ્યા હોય તેઓને લોકર્સના વ્યવહાર કરવા દેવામાં આવશે નહિ. લોકર્સની ચાવી એમ્બોઝ કર્યા વગર લોકર ઓપરેટ કરવા દેવામાં નહીં આવે તેની નોંધ લેવી. જુના લોકર્સવાળાએ નવા ફોર્મ મેળવી UP dation તાત્કાલિક કરાવી જવા તથા સપ્લીમેન્ટરી ફોર્મ પણ જમા કરાવવા.

ધિરાણોના વ્યાજના દર

તા. ૧૪-૧૦-૨૦૨૧ થી અમલમાં

અનસિકર્ચોર્ડ લોન/કેશકેડીટ	૧૧.૨૫ %	સોના ચાંદીના દાગીના સામે લોન ધિરાણ	૯.૬૦ %
હાઇપોથેકિસન કેશકેડીટ	૧૧.૨૫ %	ચીજ વસ્તુ સામે હાથર પરચેજ ધિરાણ	૧૦.૫૦ %
સ્થાવર મિલકત સામે લોન ધિરાણ	૧૦.૭૫ %	એન.એસ.સી. સામે ઓવર ડ્રાફ્ટ	૧૦.૦૦ %
સ્થાવર મિલકત સામે કેશકેડીટ	૧૨.૦૦ %	હાઉસીંગ લોન ધિરાણ	૧૦.૦૦ %
		હાથર પરચેઝ (વ્હીકલ તથા મશીનરી ધિરાણ)	૯.૫૦ %

નોંધ : બેંકમાં મુકેલ ફિક્સ ડિપોઝીટ સામે ઓવર ડ્રાફ્ટમાં ડિપોઝીટ વ્યાજના દર કરતા ૧% વધુ વ્યાજ લેવામાં આવે છે.

ફિક્સ ડિપોઝીટ માં ગ્રાહકની સુચનાથી ઓટો રીન્યુએબલની સગવડ છે.

થાપણોના વ્યાજના દર તા. ૦૧-૦૭-૨૦૨૫

૦૭ દિવસથી ૧૫ દિવસ સુધી	૪ %	૧ વર્ષ કે તેથી વધુ ૨ વર્ષની અંદર	૭.૨૫ %
૧૬ દિવસથી ૩૦ દિવસ સુધી	૪ %	૨ વર્ષ કે તેથી વધુ ૩ વર્ષની અંદર	૭.૨૫ %
૩૧ દિવસથી ૪૫ દિવસ સુધી	૪.૫૦ %	૩ વર્ષ કે તેથી વધુ	૭.૨૫ %
૪૬ દિવસથી ૧૮૦ દિવસ સુધી	૫.૦૦ %	સીનીયર સીટીઝન (૬૦ વર્ષ પુરા)	$\frac{1}{2}$ % વધુ
૧૮૧ દિવસથી ૧ દિવસ સુધી	૬.૦૦ %	બચત થાપણ ખાતુ	૨.૭૫ %

તમામ વ્યાજદર વખતોવખત ફેરફારને પાત્ર

● રીકરીંગ ખાતાના વ્યાજ ફિક્સ ડિપોઝીટ મુજબ ફક્ત ૧, ૨ અને ૩ વર્ષ માટે.

નોંધ :- સીનીયર સીટીઝન્સ માટે ૧ વર્ષ કે તેથી વધુ સમયની ડિપોઝીટ કરે તોજ બેંકના ડિપોઝીટના વ્યાજ કરતાં $\frac{1}{2}$ % વ્યાજ વધુ આપવામાં આવશે. જેનો લાભ લેવા ઉંમરનો દાખલો રજુ કરવો પડશે.

લુણાવાડા અને ખાનપુર તાલુકા તથા તેના આજુબાજુના
ગામડાના ગ્રાહકોના સહયોગથી

રૂ.૨૦૦ કરોડ ઉપરાંતનો બિઝનેસ ધરાવતી બેન્ક એટલે



ધી લુણાવાડા પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક લી.



- ★ સોનાના દાગીના ઉપર સરળતાથી ધિરાણ - ૯.૬૦% વ્યાજ
- ★ હાઉસિંગ લોન - ૧૦.૦૦% વ્યાજ
- ★ બાઘક/ઘર વપરાશ વસ્તુઓ સામે ફર્નિચર લોન - ૧૦.૫૦% વ્યાજ
- ★ કાર લોન - ૯.૫૦% વ્યાજ
- ★ ATM DEBIT CARD

સોના-ચાંદીના દાગીના ઉપર

રૂ.૩,૪૦,૦૦૦

સુધીનું ધિરાણ મળશે.

માત્ર
૮૦ પૈસાના
માસિક
વ્યાજદરે

સોના-ચાંદીના દાગીના ઉપર ધિરાણ સૌથી સસ્તા વ્યાજ દરે

સરળતાથી લોન

અધ્યતન લોકર સુવિધા

સરળ લેવડ-દેવડ

સહાયક સ્ટાફમિત્રો

તમારા ગ્રાહકને ઓળખો know your customersના નિયમનું પાલન

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા મુજબ બેંકના ગ્રાહકોની ઓળખનિતિ ફરજિયાત બનાવતા/કરન્ટ/લોકર્સ/ફી.ડી/શેરના ખાતેદારોને KYC અંતર્ગત નીચે જણાવેલ દસ્તાવેજી પુરાવા બેંકમાં રજુ કરી દેવા.

૧. પાસપોર્ટ સાઈઝના બે તાજેતરના કલર ફોટોગ્રાફ
૨. ઓળખાણ માટે નીચેનામાંથી કોઈપણ એક પુરાવાની નકલ
 - ૧) ભારત સરકારનું પાનકાર્ડ
 - ૨) ભારત સરકારનું ચુંટણી કાર્ડ
 - ૩) આધાર કાર્ડ
 - ૪) પાસપોર્ટ
 - ૫) ડ્રાઇવિંગ લાયસન્સ
૩. સરનામાના પુરાવા માટે નીચેનામાંથી કોઈપણ એક પુરાવાની નકલ
 - ૧) ટેલીફોન બીલ
 - ૨) લાઈટબીલ
 - ૩) રેશનકાર્ડ
 - ૪) ડ્રાઇવિંગ લાયસન્સ
 - ૫) ભાડે રહેતા હોય તો ભાડા ચિટ્ટી
 - ૬) બેંક એકાઉન્ટની પાસબુકની નકલ
 - ૭) આધાર કાર્ડ
 - ૮) ગર્વ. ડીપાર્ટમેન્ટમાંથી ઈસ્યુ કરેલ પત્રની નકલ

કરંટ ખાતુ ખોલાવવા માટે પાનકાર્ડની નકલ ફરજિયાત આપવી પડશે, બચત ખાતા માટે પાનકાર્ડ અથવા ફોર્મ-૬૦ આપવાનું રહેશે.

ઉપરોક્ત મુજબનાં તમામ દસ્તાવેજો જે ખાતેદારોએ રજુ ન કર્યા હોય તેઓએ તાત્કાલીક રજુ કરી દેવા નહીં તો રીઝર્વ બેંકના નિયમ મુજબ ખાતામાં લેવડ-દેવડ બંધ કરી દેવામાં આવશે.